

બિંદુ લિટરેચર્સ-૭

આત્મહત્યા



કામણી



લખક

શ્રી ભૂવનલાલનાથાચાર્ય
બ.પ.આચાર્યદેવ ક્રીમેડ વિજાય
મ.આ.

સ્ટોર્સ એન્ડ મેર્ચાર્જ
ગ્રાન્ડ ટોર્નોન્ડ
ગુજરાત

આપાદંતો સુહી હોડ્ક

લે યાનિ આટમામાં આટમાવક્

આટમાને ભાલો છે લે એ તેનાં

આરિઅ, ફાન અને ડર્ઝાન છે.

આપાણમેવ વિગતચુણજા
શ્રી ઉત્તરાધ્યન સ્ક્રા



ਲੁਟਾ

ਕਥਾਂਥੀ
ਆਵੋ ?

ਲੂਖ ਕੋਨ
ਵਾਗੇ ਛੇ ?

ਟੋਹਾ ਕੇਮ
ਆਵੇ ਛੇ ?

ਮਾਡੇ ਕਥਾਂ
ਜਵਾਨੁ
ਛੇ ?

ਆਲਾ
ਛੇ ?



ਕਖਾਂਥੀ ਅਨੇ ਬਣਿੜਾਂਥੀ ਲੁਵਾਯੇਲੋ ਆ ਆਲਾ ਜ ਸੰਸਾਰ ਛੇ.
ਅਗ ਕਖਾਂਥੀ ਨਥਾ ਬਣਿੜਾਂਥੀ ਨ ਉਤਨਾਰੇ
ਆ ਆਲਮਾਨੇ ਜ ਪੰਡਿਤੀ ਮੌਖ ਕਲੇ ਛੇ ...



આત્મ વિંતા



સ્વાધ્યપુર નગરાર



પર વિંતા

ચાર પ્રકારની ચિંતા

ઉત્તમા હ્યાત્મચિન્તા સ્યાત्

કામચિન્તા તુ મધ્યમા ।

અધ્યમા ત્વર્થચિન્તા સ્યાત्

પરચિન્તાઽધ્યમાધમા ॥

● ૧, આત્મચિંતા. ●

ચિંતા એટલે ? :-

પરમ દ્યાળું શાસ્ત્રકાર મહર્ષિ આ શ્લોકમાં ચાર પ્રકારની ચિન્તા બતાવે છે. ચિન્તા એટલે કાળજી, વિચારણા, ગડમથલ, ફિકર, ઉદ્ઘેગ, અજંપો આવા' અનેક અર્થમાં ચિન્તા શબ્દ વપરાય છે. માતાને જાત કરતાં છોકરાની વધુ ચિન્તા રહે છે, અર્થાત્ વધારે કાળજી રહે છે. પુદ્ધગલ રસિયું મન સામાયિકમાં પણ દુન્યવી ચિન્તા કરે છે એટલે કે દુનિયાદારીની વિચારણા કરે છે, વિચારો કરે છે. 'કેમ શી ચિંતામાં પડ્યા છો ?' અર્થાત્ મનમાં શી ગડમથલ કરી રહ્યા છો ? મંદિરમાં ગયા પણ બહાર જોડા મૂક્યા છે તેની ચિંતા રહે છે' અર્થાત્ ફિકર રહે છે કે ઊપરી તો નહિ જાય ? 'હવે પૈસા ગયા તે ગયા ચિંતા શું કરો છો ? એટલે કે ઉદ્ઘેગ, ખેદ, શોક શા માટે ? પૈસા તો મળ્યા પણ ચિંતા કોટે વળગાડી, અર્થાત્ અજંપો ઊભો કર્યો. આમ અનેક અર્થમાં 'ચિંતા' શબ્દનો ઉપયોગ થાય છે. અહીં ખાસ કરીને કાળજી, ફિકર અર્થ લેવાનો છે, પછી પ્રસંગવશ બીજા પણ અર્થનો સમાવેશ થાય છે.

ચિંતા કરાય અને ન કરાય :-

જીવન છે એટલે સહેજે કોઈ ને કોઈ ચિંતા રહે છે, રહેવાની. માત્ર જોવાનું એટલું છે કે શાની ચિંતા કરવી જોઈએ અને શાની

નહિ. આનું કારણ એ છે કે ચિંતાનો આત્મા પર મોટો પડ્યો પડે છે, આત્મામાં વિકાસ યા વિકાર ઘડાય છે. સારી ચિંતામાં રહેવાથી વિકાસ સધાય છે, અને ખરાબ ચિંતાના લીધે આત્મા વિકૃત બને છે, વિકારનો ભાગી બને છે. આ વિકાસ કે વિકાર પર જીવન સાંસું કે નરસું બનવાનું અને પરલોક તેવો સર્જવાનો, માટે જ ખરાબ ચિંતામાંથી બચવાનું છે, અને સારી ચિંતા ઊભી કરવાની છે, ટકાવવાની છે, વધારવાની છે.

'ચિંતાસે ચતુરાઈ ઘટે...ચિંતા ચિંતા સમાન'

એ ખોટી-ખરાબ ચિંતા નહિ કરવાની. બાકી તો કહેવાય છે ને કે ચિંતા વિનાનો માણસ નઘરોળ, મૂઠ ગણાય ! એ સારી ચિંતાનો સૂચક છે. કર્તવ્ય, જવાબદારી, સ્થાન વગેરેની ચિંતાથી પરવારેલો હોય એની પાસે શી સારી આશા રખાય ?

સારી ચિંતાથી ચાનક ને ઉધમ :-

સારી ચિંતા તો રહેવી જ જોઈએ. જીવને એ ચાનક લગાડે છે, ઉધમી બનાવે છે. ચિંતા સતેજ હશે તો ચાનક જોરદાર લાગશે અને શક્ય ઊણપમાં પણ જોશ રહેશે. ત્યારે જો ચિંતા મોળી, તો ચાનક અને ઉધમ મોળા. એટલે જ પહેલાં કહ્યું કે સારી ચિંતા ઊભી કરવાની, ટકાવવાની અને વધારવાની, એના વિના ચાલે પણ નહિ, એને ખોવી પણ પાલવે નહિ, તેમ વધાર્યે ગયા નહિ તો સારી ચાનક અને સારો ઉધમ વિકાસ પણ ન પામે.

મન મળ્યું છે પશુ કરતાં ઊંચી કોટિનું, તો નરસી ચિંતાઓ ઓછી કરવાની છે, અને સારી સારી ચિંતાઓ વધાર્યે જવાની છે એ લક્ષમાં રાખજો. પાછો આર્ય દેશમાં, આર્ય કુળમાં અને ઉત્તમ દેવ-ગુરુ-ધર્મના સંયોગવાળો જન્મ મળ્યો છે; એટલે તો સારી ચિંતા ઊભી કરવા, ટકાવવા અને વધારતા જવાની અવ્યલ તક છે, એ તકને સફળ કરવાનું કર્યું તો આ ભવચકમાં ભમતાં ભમતાં અહીં આવ્યા પર મહાન ઉન્નતિ સધાશે.

વિકાસ કે વિકાર શાથી ? :-

ચિંતા પર અહીં અને પરલોકના મહાન વિકાસ કે વિકારનો આધાર છે, કેમ કે ચિંતા જીવન પર પડધો પાડે છે, આત્માનું ઘડતર કરે છે, તેવા તેવા વાળી-વિચાર-વર્તાવને પ્રવત્તિવે છે. એમાં જો સારી ચિંતા નહિ રાખી અને નધરોળ નહિ હો તો ખોટી ખરાબ ચિંતા ઘર કરી ગઈ સમજો.

જેવી ચિંતા તેવું સંસ્કરણ :-

ત્યારે ભૂલતા નહિ કે જન્મ-જન્માંતરોમાં ખોટી ચિંતાઓ કરવામાં બાકી નથી રાખી. એનું આ પરિણામ છે કે અહીં તેવા તેવા કુસંસકારો-કુવાસનાઓનો વારસો લઈને આવવાનું બન્યું છે. જુદા જુદા જીવોમાં જુદી જુદી ખાસિયતો દેખાય છે તે શું એમ જ અક્સમાત ઊભી થઈ ગઈ છે? ના, એ તો જન્મોજન્મમાં સેવેલી ચિંતાઓથી ઊભા થયેલા ને પોષાયેલા સંસ્કારોનું પરિણામ છે. ફેક્ટરીમાં કપડાને જેવા જુદા જુદા પાશ અને રંગ દેવાય છે, તે તે પ્રમાણે એ બહાર બજારમાં આવે છે. દિવાળીમાં મીઠાઈવાળો કંદોઈ ઘઉં પર જેવી જેવી પ્રક્રિયાઓ કરી માલ તૈયાર કરે છે તે પ્રમાણે જુદી જુદી જાતની મીઠાઈ બહાર મૂકે છે. જુદા જુદા વિષયના શિક્ષકો વિદ્યાર્થીને વર્ષભર જેવું જેવું ભણાવે છે અને વિદ્યાર્થી મહેનત કરે છે, વર્ષના અંતે તે તે પ્રમાણે વિદ્યાર્થીમાં તે તે વિષયની હોશિયારી આવે છે. કાંઈ આ બધું એમ ને એમ ઉપરથી ટપકી નથી પડતું. ગણિતનો માસ્તર જો કાબેલ, તો વિદ્યાર્થી એમાં હોશિયાર થાય છે, ને ઇતિહાસનો માસ્તર જો રોબડ, તો ચાલાક પણ વિદ્યાર્થી એમાં તેવો હોશિયાર નથી થતો. તાત્પર્ય, તે તે રીતે ઘડાતાં ઘડાતાં જુદી જુદી જાતના કાપડ, મીઠાઈ અને કેળવણી ઊભાં થાય છે. બસ એ રીતે સમજો કે જુદી જુદી ચિંતાઓએ આપણને ઘડયા છે, આપણા સંસ્કારોને ઊભા કર્યા છે, એ કાંઈ આક્સિમિક ઊભા નથી થઈ ગયા. તેમ જીવનના અંતે સરવાળો આના પર નીકળણે કે કઈ ચિંતામાં જીવન વિતાવું છે.

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

કુચિંતાથી અંતે દુર્દશા :- માણસ જીવન પસાર કરતી વખતે તો બેદરકાર હોય છે, અને હલકી ચિંતાઓ કરી કરી ભયંકર રીહું કુસંસ્કરણ કરે છે, પરંતુ અંત વખતે એ મહા દુર્દશા ભોગવે છે, અને પરભવમાં તો પૂછવું જ શું? ભૂલશો નહિ જેવી તન્મય ચિંતા કરો છો એવું મહત્વ એ વિષયને અપાય છે; પછી એ જ વિષય મગજમાં ઘર કરી જાય છે, અંતે ચિંતા એમાં જ ચોટું રહે છે, ભવાંતરે એ જ સૂજે છે. માટે જ સારું પરિણામ લાવવું હોય તો હલકી ચિંતા છોડો, સારી કરો.

ત્યારે સવાલ આ આવીને ઊભો રહે છે કે

કેવી કેવી જાતની ચિંતા કેવું કેવું ઘડતર કરે છે?

શાસ્ત્રકાર ચિંતાના ચાર પ્રકાર બતાવતાં એમાં જીવની કક્ષાઓ બતાવી ગર્ભિત રીતે એના ફળનો નિર્દેશ કરે છે. ચાર ચિંતાઓમાં પહેલી આત્માની ચિંતા, બીજી કામ અર્થાત્ વિષય સુખોની ચિંતા, ત્રીજી અર્થ-પૈસા ટકાની ચિંતા અને ચોથી પરની ચિંતા ગણી.

આત્મચિંતા એ ઉત્તમ છે, વિષયસુખની ચિંતા મધ્યમ છે, અર્થ (પૈસાટકાની) ચિંતા અધમ છે, અને પરચિંતા અધમાધમ છે.

આ પરથી જીવની કક્ષા આ બને કે-આત્મચિંતાથી જીવ ઉત્તમ બને છે, કામચિંતાથી મધ્યમ, અર્થચિંતાથી અધમ અને પરચિંતાથી અધમાધમ બને છે.

આમાં પહેલી આત્મચિંતા :-

આત્મચિંતા એટલે ભવ-ભવ ભટકી રહેલા અને અત્યારે આ કાયામાં કેદ પુરાયેલા પોતાના આત્માની ભારે ચિંતા હોવી, કાળજી કરવી, દુર્દશાભરી એની પૂર્વસ્થિતિ ઘ્યાલમાં રાખી ભવિષ્યની સ્થિતિ કેમ સારી બને એ માટે ખબરદાર રહેવું તે.

આત્માની આ કાળજી ખરેખર જાગતી રાખવા માટે એની સામે શરીરની ચિંતા, કાળજી તુલનામાં ઓછી રાખવી પડશે, એવી વિષય સુખો, પૈસાટકા, અને પરની ‘તથા’ ઓછી કરવી જોઈશે. તો જ આત્મચિંતા મુખ્યપણે પ્રવર્તતી રહેશે. આત્મચિંતા એટલે બસ

૪

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

આત્મચિંતા, ‘મારો આત્મા એ મારે મુખ્ય સંભાળવાની વસ્તુ. બાકી બધું એની પાછળ,’ આ વિવેક જગ્યાત રાખવો પડે.

મંત્રીનું પ્રતિકમણ :

એક મંત્રીનો પ્રસંગ આવે છે. રાજ્ય રાણી કરે છે, એક પ્રસંગે કોઈ દુશ્મન રાજી સામે લડવા જવાનો પ્રસંગ આવ્યો. યુદ્ધભૂમિ પર પહોંચી ગયા છે, કાલ સવારે સૂર્યોદય પછી યુદ્ધ શરૂ થવાનું છે. મંત્રી પરોઢિયે તંબુમાં બેઠો પ્રતિકમણ કરે છે. એ પ્રતિકમણ ક્યાં? યુદ્ધભૂમિ પર! જ્યાં માથા પર ભારે ચિંતા હોય, જ્યાં માનવ સંહારની કિયા થવાની છે; જ્યાં બીજાઓ યુદ્ધની ધમાલમાં છે! ત્યાં મંત્રીની આત્મચિંતા કેટલી બધી સજાગ કે પ્રતિકમણ સૂઝે છે. એમાં પાછી જતના પૂર્વકની બધી કિયા, એક ખમાસમણું આવ્યું તો બેસતાં પહેલાં ચરવળાથી પાછળ પગે ત્રણવાર, આગળ પગે ત્રણવાર, નીચે ઢીંચણ માંડવાની જગ્યાએ ત્રણવાર બેસીને આખા બે હાથ અને લલાટે બેવાર, માથું નીચે અડાડવાની જગ્યાએ ત્રણવાર એમ ૧૪ વાર પૂંજી પંચાંગ નમસ્કાર કરી ઊભા થતાં પહેલાં પગની એડી પાછળની જગ્યાએ ત્રણવાર પૂંજી લેવાનું, એમ સતત સંડાસામાં પૂંજવાની કિયા. એવી રીતે વાંદળામાં તેમજ જ્યારે-જ્યારે બેસવાનું આવે ત્યારે ત્યારે પાછળ પગ તથા નીચે જમીન પૂંજી-પ્રમાર્ણ લેવાના!

આ બધી જીવ રક્ષાપૂર્વકની પ્રતિકમણ કિયા જોઈ બીજાઓને લાગ્યું કે આ શું લડશે?

રાણીને કહે છે, ‘ભગવતી! આ મંત્રી તો નાના જીવજંતુની પણ આવી આવી દયા કરે છે એ આ યુદ્ધમાં મોટા હાથી-ઘોડા અને માણસોને ઠાર કરવાનું શું કરશે?’

રાણીનો વિશ્વાસ :- રાણી મનમાં કોભ તો પામી, પરંતુ મંત્રી પર અથાગ વિશ્વાસ હતો એટલે કહે છે, ‘તમે ધીરજ ધરો; લડાઈમાં એનું પરાકમ જોજો.’

મંત્રીએ કેટલી નેકી, પ્રામાણિકતા અને એકદિલીથી જીવન જીવું

હશે કે રાણી એના પર આવા પ્રસંગે પૂરો વિશ્વાસ મૂકે છે! આત્મચિંતા વિના બનવું મુશ્કેલ છે.

જો રૂપિયા જ ભેગા કરી લેવાની મુખ્ય ચિંતા હોય તો તો નેકી-બેકી બાજુએ મુકાય છે.

આજે જુઓ છો ને? રાજ્યસેવકોમાં લાંચરુશવત-ગોટાળા કેટલા ચાલ્યા છે! કારણ કે વિચાર જ નથી કે ‘આમાં મારા આત્માનું શું થશે! હું કયા ખાનદાનનો! સકલ જીવરાશિમાં મારા આત્માને આ માનવ ભવરૂપી કેટલો ઉંચો હોદ્દો મળ્યો છે! આવો કોઈ સ્વાત્માનો વિચાર નહીં, પછી આત્મચિંતા, આત્મરક્ષણની કાળજી શાની હોય?

મોટાની અસર નાના પર :- મંત્રી આત્મચિંતાવાળો છે, પ્રામાણિક છે, વફાદાર છે, કર્તવ્યનિષ્ઠ છે. એટલે રાણીને હૈયે વિશ્વાસ છે કે આ મને ધોખો નહિ હે. સૂર્યનો ઉદ્ય થઈ ગયો એટલે ત્યાં લડાઈ થઈ. મંત્રી આગળ ઉત્સાહથી લડે છે એટલે લશ્કર પણ જોરથી લડે છે. આગેવાનની પ્રવૃત્તિની અનુયાયી પર મોટી અસર પડે છે. એમાંય ઢીલાશની છાચા વહેલી પડશે. માટે જ મોટાએ વહુ સાવચેત રહેવાનું છે. નાનાઓના હિતની ખાતર પણ મોટાનું જીવન વિનયબદ્ધ, ઔચિત્યપૂર્ણ, વિવેકી, ત્યાગી, સંયમી વગેરે ગુણસંપન્ન જોઈએ, કોઈ પણ બૂરી આદત ન જોઈએ. નહિતર નાના તો દેખશે એવું શીખશે.

લડાઈનું પરિણામ :- અહીં સાંજ પડતાં પડતાં તો મંત્રીએ વિજય મેળવ્યો, દુશ્મન હારી ગયો. પરંતુ મંત્રીના શરીરે ઠીક ઠીક ધા લાગેલા, તે એને ધવાયેલી સ્થિતિમાં છાવણીમાં લઈ આવ્યા, હવે તેની માવજત થઈ રહી છે, રાણી પાસે બેસી મંત્રીના પરાકમના ગુણ ગાય છે. ગવાઈ જ જાય; ગુણની કદર એવી ચીજ છે કે પ્રાય: હૈયે અનુમોદના અને મોઢે પ્રશંસા થઈ જાય.

સાધર્મિકની ઉપબૂંહણા-અનુમોદના :-

સમ્યગ્રૂદ્ધનિમાં ઉપબૂંહણાને એક આચાર અને અનુપબૂંહણાને અતિચાર-દોષરૂપ ગણ્યો છે. ઉપબૂંહણા એટલે કે સંધ-સાધર્મિકના

સુકૃત-સદ્ગુણ નજરે ચઢતાં એની પ્રશંસા કરવી જોઈએ, એનું સમર્થન કરવું જોઈએ. સમ્યગ્દર્શન ગુણ હોય તો સહેજે એ થઈ જાય, કેમ કે સમ્યગ્દર્શન એવી ચીજ છે કે આત્માને હવે પાપની, દોષની પકડ અને પાપ-દોષ-હુર્ગુણના પક્ષપાત મુકાઈ જાય છે, અને ગુણની પકડ-પક્ષપાતમાં દિલ ફળે છે. સંસાર પર નિર્વેદ, ઉદ્ઘેગ, કંટાળો એટલે સંસારના કારણભૂત દોષ-હુર્ગુણ પર ઉદ્ઘેગ, કંટાળો જગ્યો, અને મોક્ષ પર રુચિ થઈ અર્થાત્ મોક્ષના કારણભૂત સદ્ગુણ-સુકૃત ઉપર રુચિ પક્ષપાત જગ્યા પછી ચાહ્ય તે એક બાળકના હો કે હુશમનના.

બહુ દોષો વચ્ચે એ આરોગ્ય.

જ્યારે જ્યારે આ ઉપબૃંહણામાં ખામી દેખાય ત્યારે ત્યારે અંદરખાને તપાસવું જોઈએ કે ‘કેમ આમ થઈ રહ્યું છે ? શું ખરેખર દોષઘૃણા અને ગુણપક્ષપાત મારા હૈયામાં જગહળી રહ્યા છે કે નહિ?’ એટલું ધ્યાન રાખજો કે કોઈપણ જીવમાં દોષ-દુષ્કૃત્યો તો ઘણા છે અને તે બધા એક સાથે નથી જવાના, એમ સદ્ગુણ - સુકૃતો બધા એક સાથે નથી આવવાના, તો સંભવ છે સામા આત્મામાં અનેક દોષ-દુષ્કૃત હોય છાતાં જો થોડો પણ ગુણ પ્રગટ્યો છે તો એટલું આરોગ્ય પ્રાપ્ત થયું છે. હવે એ ગુણની કદરનો અવસર આવે ત્યારે ગીધની આંખે એના દોષો તરફ જોતાં ન બેસી રહેવાય. હા, કોઈ મહામિથ્યાદિયા મહાહુરાચારી હોય તો જુદી વાત. સાવધ રહેવું પડે. બાકી સાધર્મિકના અનેક દોષ વચ્ચે રહેલા ગુણ તરફ દિલ જોઈએ. સ્નેહી-કુઠુંબી બીમાર હોય, તાવ, ખાંસી, માથાનો દુખાવો, શરીરે કળતર વગેરે અનેક રોગ હોય, પરંતુ જો એમાં ફર પડીને એકાદ પણ રોગ શાંત પડે છે તો ખુશી થવાય છે, બીમારને આશ્વાસન-પ્રોત્સાહન અપાય છે કે ‘મૂંજાશો નહિ, જુઓ આ એક રોગ મટ્યો એ સરસ થયું છે, હવે બીજા પણ રોગ મટતાં આવશે.’

રોગ પર ઘૃણા અને આરોગ્ય પર પ્રીતિ છે તો થોડું પણ આરોગ્ય પ્રાપ્ત થતાં તેની ખુશાલી અનુભવાય છે. એવું આત્માના

ભાવરોગ-ભાવઆરોગ્ય સંબંધમાં સમજવાનું છે. જો ભાવઆરોગ્ય ગમે છે તો સંધ-સાધર્મિકમાં સદ્ગુણ-સુકૃત દેખાય તો એની પ્રશંસા, પ્રોત્સાહન કર્યા વિના કેમ રહેવાય ?

ત્યારે તમે કહેશો કે ‘પણ અમારી નજરે એના બીજા દોષ તરવરી આવે છે એનું કેમ ?’

એનું એ કે સામા પર એક સાધર્મિકબંધુ તરીકે સ્નેહ ઊભરાય છે ખરો ? એ પહેલું તપાસો. સમ્યગ્દર્શન જેમ દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા-પ્રીતિ જગાવે જ, એમ સાધર્મિક પર સ્નેહ પણ ઊભરાવે: સમ્યગ્દર્શન ચીજ એવી છે. દુનિયામાં સગાં એટલે કુછ નહિ, આત્માનાં સગાં એ જ એને સાચાં સગાં લાગે. સાધર્મિક એ આત્માનાં સગાં છે. ધર્મહીન સગાભાઈ કરતાં એના પર સ્નેહ વધુ હોય. સ્નેહાળ ભાઈના દોષ ઢાંકવા અને ગુણ ગાવાનું મન કેમ થાય છે ? તો સ્નેહપાત્ર સાધર્મિક માટે એવું ન થાય ?

દુનિયામાં દોષદર્શી કોણ કોણ ?

ત્યારે દુનિયામાં જુઓ કે દોષ જ જોયા કરવાનું અને ગુણને ઓળખવાનું કોણ કરે છે ? ઓરમાન માતા ઓરમાયા છોકરાના દોષ જ કાઢ્યા કરે છે, અને એની પેટભરી નિંદા કરે છે. તો શું સાધર્મિક એ તમારા ઓરમાયા છે કે એના દોષ જ દેખાયા કરે અને એની પેટ ભરીને નિંદા થયા કરે ? શોક્ય શોક્યને આંખમાં કણાની જેમ ખૂંચે છે તો એના દોષ જ જોવા-ગાવાનું જ કર્યા કરે છે. તો શું સ્વામીભાઈ તમારે શોક્ય જોવો છે તે આંખમાં કણાની જેમ ખૂંચ્યા કરે ? અને એના દોષ જ જોવા-ગાવાનું થયે જાય ? ગામમાં રાતના કૂતરાની દશા જોઈ છે ને ? એકને બીજો ખમાતો નથી. જત-ભાઈની સામે ઘૂરક્યા કરે છે. શું આપણે એ સ્થિતિમાં છીએ કે સાધર્મિક બંધુ આંખમાં ખમાય જ નહિ ! ને એના દોષ જ જોયા કરાય ? એની નિંદા જ લઈ બેસાય ? એની સામે ઘૂરક્યાં કરાય ? શું ઉપબૃંહણા-પ્રોત્સાહન-સમર્થન અને પ્રશંસાપાત્રની સામે ઘૂરક્યાં ? એની નિંદા ?

સાધર્મિક અને સંધ તથા ગુરુઓ વગેરેની નિદા કરતાં બહુ વિચાર કરજો, એની સાથે લડતાં કલેશકંકાસ કરતાં પહેલાં થોભજો, વિચારજો કે આપણા માટે ભગવાને સંધ-સાધર્મિક પ્રત્યે કેવા બનવાનું કર્તવ્ય ફરમાવ્યું છે ?

કર્તવ્યનો ભંગ અને જિનાજ્ઞાની વિરાધના આત્માને કેટલો બધો નીચે ઉતારી દેશો ?

- કેવાં ધોર પાપ બંધાવશે ? ભવાંતરે જીબ રહેવા દેશો ?

- દુર્ગતિ નહિ દેખાડે ? દુર્ગતિ થઈ તો વિટંબણા-દુર્દ્શા વેઢી જશે ?

શાસ્ત્રમાં એક પ્રસંગ આવે છે કે ગુરુએ પોતાના વાદી, તપસ્વી, વગેરે શિષ્યોની નિદા નહિ, ધૂરક્ષિયાં નહિ, કિંતુ માત્ર ઉપબૃંહણા જ ન કરી, પ્રશંસા-પ્રોત્સાહન ન કર્યું, અને એના અવસરે મૌન રહ્યા. તો એ આ સંસાર કૂવામાં નીચે ઉત્તરી ગયા, ભવમાં ભરકતા થઈ ગયા ! ચારિત્રનું બળ હતું, ત્યાગી મુનિ હતા તેમ નિદા-તિરસ્કાર પણ નથી કર્યા, છતાં આ દશા ! તો એવું કાંઈ બળ નથી અને નિદા, ધૂરક્ષિયાં, ઉતારી પાડવાનું આવડે છે, પરિણામ કેવું આવવાનું ?

સમ્યગ્દર્શનનો ખપ કરવો હોય તો સામાના ગુણની, સુકૃતની અનુમોદના પ્રશંસા-પ્રોત્સાહનનો ખપ કરવો પડશે, માલિક પ્રભુના અનુયાયી સંધ-સાધર્મિક પ્રત્યે નીતરતું વાત્સલ્ય ધરાવવું પડશે. હૈયામાં હેત ઉભરાતાં રાખવાં જોઈશે, નિદા, ઉપેક્ષા, અવગણના કે દ્રેષ્ઠિર્ધ-અસૂયા નહિ ચાલે.

રાણીનો સવાલ :-

પેલી રાણી મંત્રીના પરાકરના ગુણ ગાય છે, ગુણ ગાતાં ગાતાં મંત્રીને એક સવાલ કરે છે,

‘મંત્રીશ્વર ! એક શંકા પૂછું ? આ તમે પરોઢિયે તો એંગિદિયા-બેંદિયા કરતા હતા, સૂક્ષ્મ પણ જીવ ન મરે એની ચીવટ રાખતા હતા તો આવા મોટાં પંચેંદ્રિય જીવોના ખૂનખાર જંગ કેમ જેલી

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

શક્યા ! એ સમજાતું નથી.’

મંત્રી કહે છે, ‘ઓહો ! એમાં શું ન સમજાય એવું છે ? જુઓ ભગવતી ! સૂર્યોદય પહેલાં શરીર પર મારા આત્માનો અધિકાર હતો તે એણે એનો અધિકાર બજાવ્યો અને સૂર્યોદય પછી આ શરીર પર તમારી નોકરીના ડિસાબે તમારો અધિકાર હતો એટલે ત્યાં શરીરે એની રૂએ એ કામ બજાવ્યું.’

શું ? બે ખાતાં જુદાં પાડી નાખ્યાં, ને કહે છે આત્માના અધિકારની રૂએ શરીરે સૂક્ષ્મ પણ જીવોની જતના-રક્ષા કરી પ્રતિકમણાની કિયા બજાવી. અને રાણીના અધિકારની રૂએ યુદ્ધ કર્યું. પ્રતિકમણ કિયા ક્યાં ? યુદ્ધ ભૂમિ ઉપર ! ત્યારે રોજ પ્રતિકમણ ચાલુ તો હશે જ ને ? કેટલી આત્મચિંતા ! ‘આજે જરા કામ છે, પ્રસંગ છે માટે પરિક્કમણાં નહિ’ એમ નહિ, યુદ્ધભૂમિ પર પણ પ્રતિકમણ ખરું. તે પણ કેટલી બધી જાગૃતિ અને બરાબર અણીશુદ્ધ વિધિસર ! હૈયે આત્મચિંતાનો કેટલો પ્રબળ આતશ સળગતો હશે !

આ તમારા પૂર્વજીનો જવલંત ઈતિહાસ છે એનું ગૌરવ હૈયે નથી ઉભરાતું ? એ બેઠા ત્યાંથી ઉભા કરી દે એવી પ્રેરણા નથી મેળવી શકતા ? વીતરાગ-સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ અને એને જીવનમાં ઉતારનાર મહાન આત્માઓના દાખાન્તોનું ભવ્યાતિભવ્ય આલંબન મળવા છતાં જો આત્મા નહિ જાગે તો પછી ક્યાં અને ક્યારે જાગવાનો હતો ? ‘મારા પૂર્વજી આવું આવું ધર્મજીવન જીવી ગયા છે, આવા આવા સદગુણ-સુકૃતો કરી ગયા છે, તો હું પણ કેમ બાકી રાખું ? હું એ જ વીર પુરુષોનો વીર વારસદાર છું, કાયર નહિ.’

પ્રતિકમણ પર ટીકા ખોટી છે :-

મૂળ, આત્મચિંતા જાગવી જોઈએ, જાગતી રહેવી જોઈએ. તો યુદ્ધભૂમિ પર પણ પ્રતિકમણ અધરું નથી. આજના ધર્મ-વસ્તુને ઉડાવનારા કહે છે, ‘લ્યો કર્યું પ્રતિકમણ ! એવા પ્રતિકમણમાં શું માલ કે જ્યાં પછી તો લડાઈઓ લડવી છે ? ધૂમ વેપાર ખેલવા છે ?’ પરંતુ આવું

કહેનારને એ ખબર નથી કે લડાઈ લડનાર અને વેપાર બેલનાર કે રંગરાગ ઉડવનાર તો દુનિયામાં ધણ છે, પણ એમાંથી પ્રતિકમણ કરનાર કેટલા ? ત્યારે શું એ પ્રતિકમણ કરનારાઓ દંભી છે ? દંભથી કરે છે ? ના, કંઈક પણ પાપના ઉરથી, ધર્મની બુદ્ધિથી અને જિનજ્ઞા-પાલનના ઉત્તમ આશયથી કરે છે. કરીને પછી પાપમાં જવું પડે છે તેને કમનસીબી માને છે, અને પાપ કરતાં કંઈક પણ ગ્લાનિ અનુભવે છે. આ કેવાક સુંદર લાભ છે ? પ્રતિકમણને ઉવેખનારાની દશા જુઓ કે એને છે એ ? એને પાપમાં જવું પડવામાં ક્યાં કમનસીબીનો અનુભવ છે ? કે પાપ કરતાં ક્યાં લેશ પણ ગ્લાનિ છે ? તો વળી પેલા પાપભય, ધર્મબુદ્ધિ અને જિનજ્ઞાનો આશય ક્યાં છે ?

પાપભય, ધર્મબુદ્ધિ અને જિનજ્ઞારસ

આ ગ્રણ મહાન ગુણ છે, ઉન્નતિનાં અદ્ભુત સાધન છે, માનવમનના અલંકાર છે, દીવા છે. એના પર અનેક ગુણોનું સર્જન થાય છે, ઉન્નતિસાધક કેટકેટલાં સુકૃત્યો અને સદાચારોને એ જીવંત કરી દે છે, અને મનમાં પ્રકાશના પૂંજ રેલાવી સાત્ત્વિક શુભ ભાવના વગરેને એમાં વસતા કરી દે છે.

હિતોપદેશ પાછળ બણ :-

ત્રણોય ગુણો આત્મચિંતામાંથી જાગવાના એ ન ભૂલશો. એકલા શરીર અને બહારનાની જ ચિંતા હશે એને તો પરલોકનો વિચાર જ ક્યાં છે ? એને તો આ ભવ મીઠાં કરવા છે પછી પાપથી ઉરવાનું શું ? ધર્મની તાલાવેલી શી ? અને જિનવચનનો માથે ભાર શો ? કંઈક પણ મનને એમ થાય કે ‘બધું ખરું પરંતુ મારા આત્માને ન ભૂલું, બીજું તો ખોવાઈ જવાનું છે, અને ભવ ભવ ચાલી આવેલા મારા આત્માએ ઊભું રહેવાનું છે, તો આત્મહિત કેમ ભુલાય ? મહાજ્ઞાનીઓ તથા ઉત્તમ પુરુષોએ આત્મચિંતાની ભરપૂર વાતો ઉપદેશી તથા સ્વજ્ઞવનમાં આચરી તે વિચાર વિનાની થોડી જ છે ? કમ અક્કલની કે મૂઢપણાની એ વસ્તુઓ નહિ.

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

જ્ઞાનીઓએ ફરમાવેલી આત્મહિતની વસ્તુઓ પાછળ તો મહાન ચિંતન, મહાન આત્મભોગ અને દિવ્યાતિદિવ્ય જ્ઞાનનું બળ કામ કરતું હતું. એ તરફ મારાથી આંખમિચામણાં કેમ કરાય ?...’ આવી કોઈ આંતરિક ગડમથલ, સમજ અને જાગૃતિ હોય ત્યારે જ પાપનો ભય, ધર્મની બુદ્ધિ અને જિનવચનની માયા લાગે છે. અલબજ્ઞ એની પણ થોડી-વધુ માત્રા હોય, નાની-મોટી કક્ષા હોય છે; એટલે શરૂ શરૂમાં એવો જોરદાર પાપભય, પ્રબલ ધર્મબુદ્ધિ અને જિનવચનની જોરદાર માયા ન દેખાય, એટલે હજુ પાપમાં પ્રવૃત્તિ ચાલુ હોય, ધર્મને મૂકી સંસારની ઘડભાંગમાં પડવાનું થતું હોય, તથા દુન્યવી સુખ-સાધનમાં ખેંચાવાનું બનતું હોય, કિન્તુ એટલા માત્રથી સિક્કો ન મરાય કે ‘અનામાં પાપનો ભય જ નથી, ને જિનવચનની પરવા જ નથી,’ કેમ કે હજુ એ ગ્રણ અલ્યમાત્રામાં હોય, પ્રારંભિક સ્વરૂપનાં હોય, તો એટલા બહારથી જોસવાળા ન દેખાય અને પાપ, સંસાર અને દુન્યવી સુખ સામગ્રીને એકદમ ધક્કો ન મારી શકે એ સહજ છે.

કક્ષા વિચારી અવગણનાથી બચો :-

આ બહુ ધ્યાનમાં રાખવાનું છે કે આત્મચિંતા અને આત્મહિતની પ્રવૃત્તિ તથા ગુણો અનેક કક્ષાના, થોડી-વધુ માત્રાવાળા હોય છે, પ્રારંભ અમુક અલ્ય પ્રમાણમાં થઈ, ધીમે ધીમે પુષ્ટ બનનારા હોય છે, અને કેટલીય વાર જનમ જનમની મથામણ પછી જ પરાકાણાએ પહોંચનારા હોય છે. તેથી સ્વજ્ઞવનમાં હાલ અલ્ય જ પ્રમાણમાં જોઈ ખોટી નિરાશા કે ખોટા સંતાપ નથી કરવાના, કિન્તુ આગળ વધવાનો એક સરખો પ્રયત્ન ચાલુ રાખવાનો છે; તેમજ બીજાના જીવનમાં ઠીકઠીક માત્રામાં એ ન દેખાતા જોઈ એનો તિરસ્કાર, અવગણના કે અરુચિ નથી કરવાના, પરંતુ જે કંઈ અલ્ય પણ માત્રામાં છે, એને ન્યાય અને પ્રોત્સાહન આપવાનું છે. આ વિશાળ દુનિયામાં કરોડો-અબજો પશુપંખી તો બાજુએ મૂકી પણ માનવ બનેલાય કરોડોને લેશ માત્ર પણ આત્મચિંતા ક્યાં છે ? લેશ પણ પાપભય, ધર્મબુદ્ધિ અને

જિનવચનની માયાની વાતે ય શી ? એના બદલે અહીં જૈનકુળમાં આવેલો હોઈ એના દિલમાં આત્મચિંતા વગેરેનો જે મંદ પણ ઉજસ થયો છે એની કદર કરવી જોઈએ.

થોડી-વધુ માગ્રાનો હિસાબ ધ્યાનમાં રખાય તો બીજાની અવગણના, અનાદર કે નિંદા ન લઈ બેસાય. આજે જુઓ આ રોગ કેટલાયને વળયો છે ! ‘બસ, તું સાવ પરવારી ગયો છે, તારામાં કઈ જ ઠેકાણું નથી, લેશ પણ આત્માની કે ધર્મની પડી નથી...આજ સંઘમાં શું છે ? સાધુઓમાં શું છે ?...’ વગેરે વગેરે નિરાશા, નિસાસા, અવગણના અને અવર્ષિવાદના સૂર સંભળાયા કરે છે. સારું સાંભળવાનું કમ મળે છે; અનુમોદન-ઉપબૃંહણા કરનારું અને વાત્સલ્યથી નવા ઉન્નતિના માર્ગની પ્રેરણા કરનારું-સાંભળવાનું બહુ ઓછું જરૂર. થોડી-વધુ માગ્રામાં આત્મચિંતા અને ધર્મવૃત્તિ હોય છે, એ હિસાબ ધ્યાન પર નથી એટલે બધું આદર્શ જોઈએ છે. તે ય પાછું પોતે જેની ટીકા કરે છે એના જીવનમાં, પોતાનામાં નહિ ! પોતે ઘણી ય દિશામાં આદર્શમાં નથી પહોંચ્યો, છતાં માનવું છે કે મારામાં આદર્શ ગુણો છે, અથવા માનવું છે કે ‘હોય, એકદમ તે ક્યાંથી આદર્શ આવે ? મારા સંયોગો ક્યાં બરાબર છે ? એ તો ધીરેધીરે મથતાં મથતાં આગળ વધાશે,’ આ કયો ન્યાય ? પોતાના માટે જુદું હૃદય અને બીજાના માટે જુદું ? એ ટીક નથી. બીજાઓના અલ્ય પણ ગુણની, અલ્ય પણ પ્રગતિની કદર કરવી જોઈએ, સામામાં પાણી ચઢાવવું જોઈએ, અને પછી ખૂટતી વાતનું સમજાવવું જોઈએ. સામાને એકલો ઉતારી પાડવાથી, મન એકલું દુભાવી નાખવાથી, પછી એનામાં આગળ વધવાનો ઉત્સાહ જીગવાની આશા રાખવી ખોટી છે. માટે એ રહેવા દો, સમજો કે આ મહામોહ અને પાપભર્યા સંસારમાં આત્મચિંતા અને એની પાછળ પાપભય, ધર્મબુદ્ધિ તથા જિનવચનની માયા થોડી પણ જીગવી મોંઘી છે; ને એ જો સામામાં જાગી દેખાય છે તો એને ન્યાય આપો, એની કદર કરો ઉપબૃંહણા કરો અને પછી અધિક માટે પ્રોત્સાહન આપો અને કહો,

સામાને પ્રેરણા દો :-

‘મહાનુભાવ ! ભાગ્યશાળી છો કે તને આ મહામોહના ધેરા સામ્રાજ્ય ભર્યા સંસારમાં આત્મા તરફ કંઈક દાખિ પડી છે, ને તને પાપનો થોડો પણ ડર છે. પાપની અરુચિ છે. તને ધન્ય છે કે ધર્મની થોડી ઘણીય રુચિ થાય છે, જિન અને જિનવચન તરફ હૈયું આકર્ષિય છે. શાસ્ત્રોના કહેવા હિસાબે તો તું મહાત્મા, મહાનુભાવ અને પુષ્પશાળી જીવ ગણાય. વળી એમાં વધારો કરવાને માટે સર્વશ્રેષ્ઠ ભવ તું પામ્યો છે, એ વળી પુષ્પાઈનો ઓર વિકાસ છે: એમાં પાછો તું શક્તિમાન છે, દેવ-ગુરુની મહાન કૃપા તને મળી છે. હવે જરાક જો વીર્ય ફોરવે તો આગળ વધી શકે એમ છે. અને જોને જીવન તો પાણીના રેલાની જેમ વહી ચાલ્યું છે, મળેલી ઉત્તમ શક્તિ-સામગ્રી કટાઈ રહી છે, બેકાર થઈ રહી છે. માટે જાગ, ઊઠ, મહાદુર્લભ મળેલી ઉત્તમ શક્તિ-સામગ્રીને કામે લગાડી દે, આત્મચિંતાનો આતશ સળગાવ, પાપભય-ધર્મબુદ્ધિ અને જિનવચનરાગ ધીખતા કરી દે, એના અનુસારે તન-મન-ધનને કામે લગાડ, એને એમાં જ સફળ કરી લે. પરમ દયાળું પરમાત્માએ સ્થાપેલ અને આચાર્ય ભગવંત આદિએ આપણા સુધી પહોંચાડેલ ધર્મશાસન આજે આપણા જેવા પાસે મોટી આશા રાખે છે કે એને સજીવન રાખી એની પરંપરા અવિચ્છિન્ન ચાલુ રહે એવા ધરખમ પુરુષાર્થ આપણે કરીએ. આપણામાં જ જો ઠેકાણું નહિ હોય, તો નાની પ્રજા શું શીખશે ? ભાવી સંઘ કેવો થશે ? ધર્મની પરંપરા શી રીતે ચાલશે ? ત્યારે ચક્કવર્તીના પણ જંગલમાં ભૂલા પડેલા છોકરાની જેમ આપણીય કેવી દુર્દશા થશે ! માટે સ્વ અને પર ઉભયનો વિચાર રાખી ખૂબ જવલંત સત્ત પુરુષાર્થ કર...’

આવી કોઈક મુલાયમ પદ્ધતિએ આજે કામ લેવા જેવું છે. સામાને ઉતારી પાડવાને બદલે, તમારામાં છે આ ? છે આ ? ક્યાં ઠેકાણું છે ? એકલું એમ જ કહી કહી ખાંડવાને બદલે, ઉપબૃંહણા-પ્રોત્સાહન કરવાની જરૂર છે. ‘સામામાં જે થોડું ય સારું છે એની કદર

કરી પાણી ચઢવવા જેવું છે, અને ખામી ટાળવાના શાસ્ત્રે કહેલા સક્રિય માર્ગ બતાવવા જેવા છે.

વાત આ ચાલે છે કે દુનિયાના પાપમાં પડેલો છતાં પ્રતિકમણ કરે છે તો એને કંઈક પણ આત્મચિંતા છે, પાપનો ભય છે, ધર્મની બુદ્ધિ છે, જિનવચનની માયા છે. જો કે આ એકાન્ત નથી, અભવી-દુર્ભવી ય કેવળ પૌદ્રગલિક લાલસાથી પ્રતિકમણ કરે, યાવત્ ચારિત્રેય પણે, એનામાં કોઈ આત્મચિંતા કે પાપભય વગેરે ન હોય, છતાં વર્તમાનમાં જ્યાં આવી લાલસા નથી દેખાતી, અને સમજી-બૂજુણે પ્રતિકમણાદિ કરવાનું કરે જાય છે, ત્યાં પછી એ હિસાબ ન મંડાય કે ‘એ હજુ પાપો તો કરે છે, રંગરાગ તો બેલે છે. માટે એનામાં આત્મચિંતા જેવું કંઈ છે જ નહિ, કશોય પાપભય કે ધર્મબુદ્ધિ નથી.’ આવો હિસાબ ન મંડાય, સીધાં એવાં જજ્ઞમેન્ટ ન આપી દેવાય.

ચરમાવર્તમાં આત્મચિંતા :-

આત્મચિંતા અને પાપભય વગેરે ઉત્કૃષ્ટપણે જાગે એની તો બલિહારી છે; પરંતુ થોડીય જાગે તો એ કંઈ કાઢી નાખવાની વસ્તુ નથી, મામૂલી વસ્તુ નહિ, ભવિષ્યની અદ્ભુત ઉન્નતિનાં આ પ્રથમ પગથિયાં છે. આત્મચિંતા આ જીવને, શાસ્ત્ર કહે છે, અનંતાનાં પુદ્રગલ પરાવર્તના કાળ વીતે છતાં થતી નથી. એ તો માત્ર મોક્ષ પામવા પૂર્વના છેલ્લા પુદ્રગલ પરાવર્ત-ચરમાવર્ત કાળમાં જ થાય છે. જીવ અનાદિ કાળથી માત્ર પુદ્રગલનો રહિયો છે. ‘માટી ખાના, માટી પીના, માટીમેં રમજાના’ બસ આજ કરતો આવ્યો છે. ‘આત્મા જેવી કોઈ વસ્તુ છે, એને આ પુદ્રગલના ફાંસલા શા?’ આવો વિચાર સરખો નહિ, પછી ભલેને એ ફાંસલાના યોગે ચાલુ જીવનમાંય પછાડ ખાવી પડતી હોય, હેરાન-પરેશાન થવું પડતું હોય, અને ભવાંતરે ઘોર નરકાદિ ગતિઓમાં બ્રમજા કરતાં કરતાં કારમાં દુઃખ-ત્રાસમાં પડવું પડતું હોય, છતાં ‘પુદ્રગલના સંબંધ એ એક ફાંસલો છે’ એવી કલ્પના સરખી નથી આવતી. એ તો આવે છે ચરમાવર્ત કાળમાં. ત્યાં પણ જ્યારે આત્મચિંતા જાગે ત્યારે.

પુદ્રગલનો ફાંસલો :-

આત્મચિંતા જગાડવા માટે આત્માને શરીરથી અલગ સમજવાનો છે. આજ સુધી શરીરને હું હું કરીને ફર્યા છીએ એટલે એના ગાઢ સંસ્કારને લીધે જટ આત્મા પર દસ્તિ જવી મુશ્કેલ છે. પરંતુ એ વિચારો કે આપણી આજુબાજુના પદાર્થો, મકાન, તિજોરી, સરસામાન, અને બીજા પણ જડ પદાર્થોને આપણી કોઈ ચિંતા નહિ, અને આપણને એની ચિંતામાં શા માટે શેકાવાનું? એ બધું આપણને અનુકૂળ જ રહે એવો નિયમ નહિ પણ આપણે એને અનુકૂળ જ કેમ વર્તવું પડે છે? જરૂર આ બધા જડ પુદ્રગલનો આપણા પર એક ફાંસલો છે. રાત ને દિવસ એના લીધે એની જ ગુલામી કર્યા કરવી પડે છે, એની પૂરી સારસંભાળ રાખ્યા કરાય છે, અને છતાં એ સરવાળે વાંકા થઈ બેસે છે! મૃત્યુ વખતે નફફટની જેમ પોતે તદ્દન સલામત ઊભા રહી આપણને મરવા હે છે! ત્યારે આત્માને આ બધો ફાંસલો શા માટે?

આત્મચિંતા જાગે એટલે મનને એમ થાય કે ‘હું કોણ? કયાંથી આવ્યો? મારું જ શરીર, છતાં કેમ મારે એની વેઠ કરવી પડે? વેઠ કરું કરું છતાં કેમ વાંકું થઈ બેસે છે? કેમ એ બરાબર મારી ઈચ્છા મુજબ નથી ચાલતું? કેમ એ ઘસતું જાય છે, રોગી થાય છે, થાકી જાય છે? કેમ આ બધું? વળી શા માટે મને ભૂખ ને તરસ, રાગ ને દ્રેષ, ગર્વ ને ગુસ્સો, આવા આવા વિકારો જાગે છે? ત્યારે કેઈ ધારણાઓ નિષ્ફળ જાય છે, અને અણધારી આપત્તિઓ આવે છે, એવું કેમ?...’ આવો વિચાર કરવો. વિચાર પણ ખરી હદ્યની ચિંતાથી કરવો. માણસ જેમ વેપારમાં ધક્કા લાગતા હોય, તો ચિંતામાં પડી જઈને વિચાર કરવા લાગે ને? એવી રીતે ચિંતામાં પડી જઈને આત્માનો વિચાર કરવા લાગવું જોઈએ.

આવા વિચારથી શરીરને છોડીને અંદરના આત્મા પર લક્ષ જાય, કારણભૂત પૂર્વ કર્મ ઉપર દસ્તિ પડે, પછી એ આત્મચિંતા કરવી કે ‘તો પછી હવે પાપો કરી કરીને કર્મ રોગ વધારવાનું શા માટે કરવું?

ભગવાન જિનેશ્વર દેવોએ સ્વયં પાપનાં જીવન બંધ કર્યા, મોટમોટા રાજ્ઞમહારાજા અને શેઠશાહુકારોને પણ બંધ કરાવ્યાં એમ, જગતને એ જ ફરમાવ્યું, પછી મારે શા સારું આ ચાલું રાખવું ? હું અરિહંતને માનનારો-પૂજનારો, અને પાપ જીવનનો રસિયો ? એ નાથે જડ પુદ્ગલમાત્રના બંધનથી ધૂટવાનું કર્યું અને કહ્યું, તો હું એથી ઉલટું એના ફાંસલા હાથે કરીને ઉભા કરું ? આ પુદ્ગલના ફાંસલા અને પાપજીવન માનવ આયુષ્યરૂપી ચંદનની હોળી કરી રહ્યા છે. આત્મા પર કર્મના ઢેર ઉભા કરી આગામી ભારી દુઃખને નોતરી રહ્યા છે, ત્યાં મારું થશે શું ? આમ વિચાર કરીને પુદ્ગલના ફાંસલાની ખટક અને પાપનો ભય જાગતો કરી દેવો જોઈએ.

આત્મચિંતા જ્ઞાયા પછી પહેલું કાર્ય પાપનો ભય ઉભો કરવાનું છે, પાપભર્યા સંસારનો કંટાળો ઉભો કરવાનું છે.

શાસ્ત્ર કહે છે, ભવનિર્દેશ એ જ ભગવદ્-બહુમાન છે,

પાપ અને પાપભર્યા સંસાર પર કંટાળો એ જ પ્રારંભિક અવસ્થામાં ભગવાન અરિહંત પરમાત્મા ઉપર બહુમાન છે. મનમાં નક્કી કરવાનું કે ‘આપણને પાપનો અને સંસારનો રસ નહિ, હોંશ-હોણિયારી નહિ, કેમ કે અરિહંત ભગવાન પાપ અને પાપભર્યા સંસારથી મુક્ત થયેલા છે, મૂકવાનું કહે છે, તો પછી આપણને પાપ અને પાપભર્યા સંસાર ઉપર હેત શાના હોય ? રસ શા માટે હોય ? કંટાળો જ હોય. કોઈનો જરાક તિરસ્કાર પણ કરવાનું પાપ કરવાનું આવે ત્યાં પણ હૈયું દુખાય; કડવો શબ્દ બોલતાં પણ દિલ દુખાય પછી પહેલે પ્રાણાત્મિપાતથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધીના પાપને કેમ જ આવકારાય ?

જીવન એવું પવિત્ર નિષ્પાપ ઘડી દેવું જોઈએ કે પાપને સ્થાન ન મળે; ભય લાગે કે ‘ક્યાંક પાપ તો નહિ લાગી જાય ? સુખ-સગવડ ઓછી મળે એની ચિંતા નથી, મારા આત્માની મોટી ચિંતા છે, એ બધું તો આવ્યું ને ગણું ! જ્યારે, આત્મા તો ઉભો રહેવાનો છે. માટે પાપમાં મારું કામ નહિ, ભગવાને કહેલા માર્ગથી સહેજ પણ

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

આધ્યોપાછો ન ચાલું, ભગવાને જેને પાપ તરીકે ઓળખાવ્યા તે પાપ જ. રખેને મને એ પાપ ફસાવી ન જાય ! રખેને મારે એમાં પડવાનું ન થાય !

મૈત્રીનું કારણ અને કાર્ય :-

પાપનો ભય એ તો ગુણોનો પાયો છે, ધર્મ મહેલનો થાંભલો છે. પાપભયની ઉપર દોષો ટળે, અને ગુણો ઉભા થાય. તથા ધર્મમહેલ ટકી શકે. દા.ત. બીજા પર દ્રોહ-દ્રોષ-ઈર્ષા વગેરે પાપનો ભય લાગે, તો એ ટાળી દિલ શાંત કરાય, મિત્રભાવ રખાય. આ મૈત્રીએ કમશઃ જીવને અહિંસક ભાવમાં લઈ જાય છે. પણ એનું મૂળ પાપનો ભય. એ ભયને કાયરતા સમજતા નહિ, એના પર જ સાચી વીરતા આવે છે. એમ તો જંગલના સિંહ, વાઘ બહુ પરાકમ દેખાડે છે, ગુસ્સે ચેલેલા સાપ-અજગર વીરતા દેખાડે છે, પરંતુ શું કરવાની એ વીરતાને ? વીરતા તો તે કે જે જગતના કર્મપીડિત જીવોનું ભલું કરતી હોય, સ્વાત્માને કર્મના કારમા બંધનમાંથી મુક્ત કરતી હોય, પુદ્ગલના ફાંસલામાંથી છોડાવતી હોય, એવી વીરતા ત્યારે જ આવે કે પાપના નામથી ય ગભરામણ લાગે, પાપની વાતમાં સૂગ ચઢે.

રાજ્ય સંપત્તિથી ભય :- અભયકુમારને પિતા શ્રેષ્ઠિક રાજા કહે છે કે ‘હવે આ રાજ્ય પર તારો અભિષેક કરવાનો છે !’

ત્યાં અભયકુમારને હોંશ નથી ચડતી, આનંદ નથી ઉભરાતો; એ તો પાપથી ગભરાય છે; ‘હાય ! રાજા થાઉં તો પાપો કરવા પડે તેથી નરક ઉભી થાય તો ? ભવભ્રમણ વધે તો ? હા, રાજા થયા પછી પણ ચારિત્ર-દીક્ષા મળતી હોય તો તો હજ્ય કંઈક બચાવ થાય. પણ ન મળે તો તો આ પાપના જમેલાથી બાર જ વાગી જાય ને ?’

કેટલો પાપનો ભય ! પાપભર્યા રાજ્ય સંપત્તિ જેવા ય સંસારનો ભય ? ત્યારે સમજાય છે કે અત્યાર સુધી મંત્રીગીરીની દુર્બાધી ભોગવી હશે પણ ભીતરના કેટકેટલા પાપભયને જગ્રત રાખીને ?

પિતાને કહે છે ‘જરા ખમો, પિતાજ ! ભગવાનને પૂછી આવું.’

૧૮

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

શું પૂછવું છે ? 'રાજ્ય લઉં કે નહિ, એમ ?' ના, રાજી બનવું પડે છે, તો પછી પણ દીક્ષા મળે એમ છે ને ? આ નક્કી કરવું છે. ગયા પ્રભુ પાસે, પ્રભુને પૂછે છે.

'ભગવન્ ! આપના શાસનમાં છેલ્લા રાજ્યિ કોણ ?'

અર્થાત્ 'જો આગળ ભવિષ્ય કાળનાનું કોકનું નામ આવે તો તો હું જાગતો બેઠો છું; આમ રાજ્યપાટ છોડી દીક્ષા લેવાનો,' આવી ખબરદારી છે, ધગશ છે, અંતરને એ સત્તાનાં સિંહાસન અને વૈભવ વિલાસનાં કામણથી બરાબર અણગું રાખવાની વાત નિર્ધારિત છે.

પરંતુ અહીં વીર પ્રભુ તો કહે છે, 'છેલ્લા રાજ્યિ તો જો આ ઉદાહન થઈ ગયા.' એટલે ? હવે રાજી થઈને ઝાંખિ થનાર આ પાંચમા આરામાં કોઈ નહિ. બસ ખલાસ, અભયકુમારે નક્કી કરી લીધું. કે મારે રાજી નહિ થવાનું.

આવીને પિતાને કહે છે, 'મહાવીરના ભક્ત આપ, આપનો દીકરો ય એ જ પ્રભુનો ભક્ત છતાં રાજી થઈ દીક્ષા વિના નરકે જાય, એવું ઈચ્છો ખરા ?'

કોણિકના ભય કરતાં પાપનો ભય મોટો :-

શાના ઈચ્છે ? વીર પ્રભુના પાકા ભક્ત છે, સમ્યગ્દર્શનનાં અજવાળાંવાળા છે. તીર્થકર થવાના છે એટલે યોગબિંદુ શાસ્ત્રના હિસાબે કહીએ તો એમણે જગતના જીવો પર કરુણા ચિંતવી છે. પોતે તો પાપથી છૂટવાની તમન્નાવાળા ખરા જ, પરંતુ જગતને પણ છોડવવાની ઊલટવાળા છે. અભયકુમારને ખુશીથી દીક્ષા લઈ પાપની કેદમાંથી છૂટવાની રજા આપી દે છે. દીક્ષામાં અંતરાય કરવાનું ઘોર પાપ કેમ કરાય ? પાછળ પુત્ર કોણિક નાલાયક છે, કોણ જાણે શું ય કરે ? પરંતુ એના ભય કરતાં પાપનો ભય મોટો છે; કેમ કે પેલો તો કદાચ આ એક ભવમાં નુકસાન કરે; ત્યારે પાપ ભવોભવ હેરાન કરે

પિતા-પુત્ર કેવા પાપના ભયવાળા ! કેવી આત્મચિંતાવાળા !
રાજી પ્રદેશી પહેલાં નાસ્તિક હતો, આત્મ તત્ત્વ માનતો નહોતો,

ઉપરથી એને ઉડાવવા માટે જીવતા માણસને રેસી નાખવાનું ઘોર પાપ કરનારો હતો, છતાં કેશી ગણધર મહારાજ મળ્યા, વાદવિવાદ થયો અને ગણધર મહારાજે આત્મચિંતા જગાડી દીધી, પાપનો ભય લગાડી દીધો, તો પ્રદેશીનું આપું જીવન પલટાઈ ગયું ! ત્યાં ને ત્યાં પહેલી મુલાકાતમાં સમ્યગ્દર્શન અને શ્રાવકનાં પ્રત સ્વીકારી લીધાં. પછી થોડો જ વખત જલ્દો, વિષયાંથ રાણીને હવે એ અકારો લાગ્યો તેથી એણે ઝેર દીધું, પણ પ્રદેશી રાજી સમાધિમાં મરીને સૂર્યાંબ વિમાનનો માલિક વૈમાનિક દેવ થયો ! મૂળ શાના ઉપર ? આત્મચિંતા અને પાપભય ઉપર.

ક્યો પાપભય આત્મચિંતાના ઘરનો ? :-

'પાપ કરીશ તો લોકમાં ખરાબ દેખાશે, અગર રાજકીય દંડ થશે,' એમ કરીને પાપનો ભય લાગે એ જુદો; એ આત્મચિંતાના ઘરનો નહિ, પરંતુ 'જો પાપ કરીશ તો મારો પરલોક બગડશે, સંસારમાં ભટકવાનું વધશે, આત્મામાં દુર્ગુણ વધશે, આત્માનું સ્વરૂપ ખરાબ થશે.' આવા કોઈ વિચારે પાપથી ડરતા રહેવાય, એ પાપભય આત્મચિંતાના ઘરનો સમજવાનો છે. લોકભય કે રાજભયથી પણ પાપ ન કરે તે સાંદું છે, પરંતુ એમાં મૂળ આત્માની ચિંતા નહીં હોવાથી જ્યાં એમ દેખાય કે 'ચાલો છૂપી રીતે પાપ કરી લેવામાં કોઈ જાણવાનું નથી,' તો ત્યાં પાપથી બચાશે નહિ, હોંશથી પાપ થશે; અને પાછળથી કોઈએ ન જાણું તથા ઐહિક કોઈ લાભ થઈ ગયો, પછી મનને આનંદ આનંદ રહેશે. આજના કાયદાના યુગમાં આ સ્થિતિ દેખાય છે. આત્મચિંતાના ઘરનો પાપભય નથી, માત્ર લોક અને કાયદાનો ભય છે, તેથી છૂપાં પાપ, જેવાં કે લાંચ-રુશવત, હિસાબી ઘાલમેલ, માલમાં ભેળસેળ, દુરાચાર, વગેરે બહુ વધી ગયા.

ત્યારે જો આત્મચિંતા હોય કે 'પાપથી કદાચ અહીં કોઈ લાભ થઈ ગયો પણ પરલોકમાં કેવી દુર્દશા ! આત્મામાં દુર્ગુણો વધે, મજબૂત થાય એ કેટલી ખરાબી !' આવી આત્મચિંતા હોય તો છૂપાં

પણ પાપ કરવાનું હિંદુ નહિ થાય. કદાચ મોહના આવેશથી થઈ ગયું તો એના પર રાજ્યો નહિ રહે. કેમ કે આમાં બહાર લોકને ખબર પડવા ન પડવાનો સવાલ નથી, પણ નજર સામે આત્માની મહાભરાણી તરવરી રહી છે, માનવ જીવનની બરબાદી દેખાઈ રહી છે.

એટલે કહો કે જ્યાં જ્યાં આવો પાપનો ખરેખરો ભય રહે છે, કે ‘રખેને હું પાપમાં ન પડું, મારા હાથે પાપ ન થઈ જાય,’ ત્યાં લોકનિંદા કે રાજુંડનો વિચાર નથી, પરંતુ અંતર્ગત આત્માની ચિંતા છે, આત્માની કાળજી છે.

૨. ધર્મબુદ્ધિ :-

આત્મચિંતા માટે પાપના ભયની જેમ ધર્મની બુદ્ધિ, ધર્મની લેશયા આવશ્યક છે, શક્ય એટલો ધર્મ સાધી લેવાની તાલાવેલી જોઈએ. બીમારને પેટનો કચરો કાઢવાની દવા જોઈએ છે, એમ શક્તિ લાવનારી દવાની પણ જરૂર પડે છે. એવું અહીં છે. પાપથી બચ્યા પણ સાથે ધર્મ ન સેવ્યો તો કૌવત નહિ આવે, ધર્મ કૌવત લાવે છે, આત્માને પુષ્ટિ કરી આપે છે.

શાસ્ત્રે કહું છે ‘શુદ્ધસુષ્ટિ લક્ષણો ધર્મः’ શુદ્ધ એટલે આત્માના મહિન ભાવો ટળી વિશુદ્ધ નિર્મળ ભાવ જાગ્રત થાય. પુષ્ટિ એટલે પુષ્યાનુંધી પુણ્ય વધે.

આ પુણ્યમાં એવી તાકાત છે કે આત્માને ઉત્તરોત્તર આગળ વધવા માટે અનુકૂળ સામગ્રી ખરી કરી દે છે. શરીર સારું મળે એટલે તપસ્યા, દેવ-ગુરુભક્તિ, જ્ઞાનધ્યાન વગેરે કરવા તરફ પ્રેરાય; પૈસા મળે એટલે દાન પરોપકાર, શાસન પ્રભાવના કરવા તરફ વળે; પરિવાર સારો મળે એટલે એક બીજામાં ધર્મની વૃદ્ધિ તરફ પ્રયત્ન થાય, બુદ્ધિશક્તિ સારી મળે એટલે શાસ્ત્રાધ્યયન, તત્ત્વચિંતન, સંધ-શાસનની સેવા વગેરે તરફ ઉદ્ઘમ રહ્યા કરે. લાગવગ સારી સારી મળે એટલે ધર્મનાં કામો કરાવી લેવા તરફ મુખ્ય લક્ષ અને પ્રયત્ન રહે.

પુષ્યાનુંધી પુણ્યમાં આ તાકાત છે, અને એ શુદ્ધ ધર્મસાધનાથી

મળે છે. પાપાનુંધી પુણ્ય હોય તો એ શરીર, આરોગ્ય, પૈસા, પરિવાર વગેરે મળે ખરા, પરંતુ એ બધાનો ઉપયોગ પાપ આચરવા તરફ થવાનો. માટે કહું કે ધર્મસાધના શુદ્ધ થવી જોઈએ; પાપનો ભય જીવતો જાગતો રાખી પુદ્ધગલની માયા વિસારીને કેવળ આત્મકલ્યાણ માટે ધર્મસાધના કરવી જોઈએ.

ધર્મ કરીએ, કરીએ ને પોતાના આત્માનું હિત ભૂલી વિનશ્વર કંચન-કીર્તિના લક્ષ શા રાખવા’તા ? એથી તો ઊલટું આત્મહિત ધવાય છે, આત્માને સંસારની બેડીમાં જકડવાનું વધે છે ! મન તુચ્છ વાસનાવાળું બને છે. એ તો એક જ લક્ષ રાખવાનું કે આત્માનું હિત કેમ વધે ! જડ માયાનું ધ્યાન રાખવાથી ક્યાં અમર થઈ જઈએ છીએ ? ક્યાં શાશ્વત સુખ ટકે છે ? મારા કેદ પૂર્વજી અને આખી દુનિયાના માણસો મૂકી મૂકીને ચાલતા થઈ ગયા, વર્તમાનમાંય ચાલી રહેલા દેખાય છે. તો મારેય શું ટકવાનું હતું ? ટકવાનો છે એક મારો આત્મા, તો અને જ સંભાળી લઉં, આત્માની રક્ષા કરી લઉં.’-આ તમના જોઈએ.

મેલી ધર્મબુદ્ધિથી શુદ્ધ ચિત્તનો નાશ :-

આત્મચિંતા જાગે એટલે સહેજે ધર્મબુદ્ધિ આવે; અને તે પાછી મેલી ન હોય. મેલી એટલે હુન્યવી સુખ સંન્માનની લાલચથી ધર્મ કરી લેવાની બુદ્ધિ; ધર્મ કર્યા ઉપર અનાં ફળ તરીકે એ સુખ-સાહિત્ય અને સંન્માન પામવાની જંખના. આ ગોઝારી છે, પછી મનગમતું મળવા ઉપર કેવળ પાપપરાયણતા આવે છે; કેમ કે એણે શુદ્ધ ચિત્તનો નાશ કર્યો હોય છે. તેથી આગળ ઉપર હવે મેલું મન ઊભું રહે છે. ત્યારે પાપ પરાયણતાનું પરિણામ ? ધોર નરકાદિ ગતિમાં ઘસડાઈ જવાનું વળી; બીજું શું ? વાસુદેવો પૂર્વે ધર્મ કરીને આવ્યા છે. પરંતુ સાથે પૌદ્ધગલિક લાલસા પાછળ ચિત્ત બગાડીને, એટલે હવે મોટી ઠકરાઈ ને માન સંન્માન તો પામ્યા, પણ પાપપરાયણ બની નરકમાં ઘસડાઈ ગયા !

શુદ્ધ આત્મચિંતામાં શું વિચારવું ?

આપણી વાત આ છે કે શુદ્ધ આત્મચિંતા રાખી ધર્મબુદ્ધિ જાગતી રાખવાની અને ધર્મ સેવવાનો. ‘અનાદિ અનંતકળથી આ મારો આત્મા ભવયકમાં ભમી રહ્યો છે, કૂવાના અરથહની ઘડીની જેમ ઊંચે ચઢી નીચે પડી રહ્યો છે, અનેક પ્રકારની વાસનાનાં વમળ, રાગદ્વેષના આવર્ત અને દુઃખોની જાળમાં અટવાઈ રહ્યો છે, તો હવે એનો ઉદ્વાર કરું. આત્માની વાસનાઓ ઓછી કરું, રાગ-દ્વેષ-કામ-કોથ-લોભ-મોહનાં સેવન ઘટાડું; અને જીવનમાં પાપ પાપને બદલે ધર્મ ધર્મ પ્રસારી દઉ’...આ આત્મચિંતા જાગતી કરી દેવાની છે.

આત્મચિંતાની ઉપર ધર્મબુદ્ધિ જગાવવાની, ‘મહાપુણ્યે મળેલી તન-મન-ધન-ઇન્ડ્રિયો અને વાણી તથા સામગ્રી-સરંજામ કેમ જ્યારે ને ત્યારે ધર્મમાં કામે લગાડું.’ એ ભાવના મનમાં રમ્યા કરે. મોકો મળે કે કોઈ ને કોઈ ધર્મસાધના એનાથી થઈ જ સમજો. દુનિયામાં જુઓ પૈસાની જ મુખ્ય બુદ્ધિવાળા પૈસા કમાવા તરફ દોડે જ છે ને ? ખુરસીની તમન્નાવાળા એની પૂઠે લાગી જાય છે, સ્ત્રીને ખુશ રાખવાની બુદ્ધિવાળા એની પાછળ તન-મન-ધનને કામે લગાડી દે છે, એમ અહીં એવી ધર્મબુદ્ધિ ઊભી કરવાની કે રાત ને દિવસ ધર્મ કમાઈ લેવા તરફ મુખ્ય લક્ષ રહે અને પ્રયત્ન થયા કરે. મૂંગાશો નહિ કે આમાં સંસારનાં કામ અટકી જશે; એ કોઈ અટકવાનાં નથી, એ તો થયા કરવાના છે, પરંતુ એમાં અને એની વચ્ચમાં ધર્મ ગોઠવી દેવાનો છે.

ધર્મબુદ્ધિના પ્રયોગ :-

દા.ત. જમવા બેઠા ત્યાં પહેલું એ યાદ આવે કે ‘કોઈ સાધર્મિક, કોઈ દીન- દુઃખીને દાન કર્યું કે કેમ ?’ કારણ કે સેવા, પરોપકાર એ તો જીવનું ભૂષણ છે. માટે એ તો જીવનમાં વારંવાર જોઈએ. વળી,

જમતાં પુદ્ધગલના ખેલ યાદ આવે; ‘આ બધું ઊતર્યું ઘાટી ને થયું માટી, એ જાતનું છે; માટે મોહ ન કરવો. છતાં અન્નની વેઠ કરવી પડે છે તો એના દ્વારા ઊભા રહેલા શરીરથી આત્મહિત ખૂબ સાધી

લઉ’ એમ જમતાં જમતાં ધમાનણારના છઠ-છઠનાં પારણે આંબેલ, નંદનઝિંબિનાં લાખ વરસનાં માસખમણ, શ્રી મહિનાથ ભગવાનના પૂર્વભવની ઘોર તપસ્યા...એવું કંઈક યાદ આવે.

એમ વેપાર કરતાં કરતાં ન્યાય, નીતિ, સત્ય તરફ નજર રહે; લક્ષ્મીના અનર્થનો ખ્યાલ, દાનાદિના મનોરથ વગેરે સ્કુરે.

એ અથવા બીજી સાંસારિક પ્રવૃત્તિમાં ધરવાસ એ પાપવાસ હોવાનો ખ્યાલ, અનિત્ય, અશરણ આદિ ભાવના, ઇન્ડ્રિયો એ આત્માની ભાવશત્રુનું કામ કરતી હોવાનો જાગતો ખ્યાલ...આવા શુભ સંવેદન રહે.

સાંસારિક પ્રવૃત્તિમાંથી ફારગ થયા એટલે દાન-શીલ-તપ-ભાવના, સામાયિક સ્વાધ્યાય, જાપ, દેવભક્તિ, ગુરુભક્તિ, સંઘસેવા, વગેરેમાંના કાંઈ ને કાંઈ ગોઠવાઈ જ જાય. જુઓ મંત્રી યુદ્ધભૂમિ પર પરોછિયે પ્રતિકમણ કરવા બેસી ગયા ને ?

સ્થૂલભદ્રજીનો વિવેક :- મૂળમાં આત્મચિંતા અને ધર્મબુદ્ધિ જોઈએ. સ્થૂલભદ્રજી વેશયાને ત્યાં રહ્યા ત્યાં સુધી રહ્યા, પરંતુ રાજાએ જ્યાં મંત્રી-મુદ્રિકા આપવા માંડી ત્યાં આત્મચિંતા સજાગ થઈ વિવેક પ્રગટ્યો, ધર્મબુદ્ધ સ્હુરી અને મંત્રીપણામાં આત્મા અને ધર્મ બંને ખોવાનું દેખાયું. માત્ર એમાં જ નહિ, પરંતુ સમસ્ત સંસાર, બાર વરસની પરિચિત વેશ્યા અને બીજે બધે ગુમાવવાનું દેખાયું, તો મંત્રીમુદ્રિકા ન લેતાં મોક્ષમાર્ગ અપનાવ્યો ! મુનિ બની ગયા ! રાજા અને વેશ્યા બંને ય જોતા રહી ગયા અને સ્થૂલભદ્રજી મહાત્યાગના માર્ગ ચાલી નીકળ્યા !

● ચંદ્રસારની કથા ●

સમરાદિત્ય ચરિત્રમાં ચંદ્રસારનો એક પ્રસંગ આવે છે. પત્નીને ધારપાડુઓ ઉપાડી ગયા છે. પૈસા આપી એને પાછી લાવવા પતિ ચંદ્રસાર નોકરને લઈને જાય છે. રસ્તામાં એક ઠેકાણ થોડું રોકાઈ આગળ ચાલે છે એ વખતે નાણાં કોથળી નોકરના હાથમાં અને ભાતા પોટલી શેઠના હાથમાં છે. નોકરની બુદ્ધિ બગડે છે અને પ્રયત્ન કરી જંગલ વચ્ચે શેઠને કૂવામાં ધકેલી દે છે.

ભયમાં નમો અરિહંતાણં :- હવે જુઓ ધર્મબુદ્ધિના નમૂના. જેવો એ અંદર પડતાં ધબ અવાજ થયો કે તરત અંદરમાં અવાજ આવ્યો ‘નમો અરિહંતાણ’. એને આશ્રય થાય છે કે, અરે ! આ તો પત્નીનો જ અવાજ ! એ અહીં ક્યાંથી ? કહે છે ‘ગભરાઈશ ના, એ તો હું જ છું, પણ તું અહીં ક્યાંથી ?’

પત્નીને ગભરામણ થઈ છે, પરંતુ તે વખતે ય ઝટ ‘ઓ બાપ ! ઓય મા ! હાય મરી !’ આવું કંઈ ન સ્કુરતાં ‘નમો અરિહંતાણ’ સ્કુરે છે, અંતરમાં રમી રહેલી ધર્મબુદ્ધિ સૂચવે છે. જીવનમાં કંઈ ને કંઈ વિષમતા ઉભી થાય છે ને ? એવા અવસરે આ જ યાદ આવે એવું કરવાનું છે. અભ્યાસ પાડતાં પાડતાં બને એવું છે. માત્ર મૂળમાં આત્મચિંતા અને ધર્મ લગની ઉભી કરજો. એ ધગશ કેળવજો કે ‘મારા તારણાહાર ત્રિલોકનાથ અરિહંત પ્રભુને શાસે શાસે સ્મરવા જેવા કરી દઉ.’

પત્ની કહે છે, ‘લૂંટારા મને લઈ જતાં અહીં રાતવાસો કર્યો. મેં જોયું કે એની પલ્લીમાં પહોંચ્યા પછી તો મારા શીલની રક્ષા ક્યાંથી ? માટે પ્રાજ્ઞ જાઓ પણ શીલ ન જાઓ, એ તમન્નાથી મેં અહીં ચૂપકીથી પડતું મૂક્યું, ને એ લોકો એમ જ ચાલી ગયા. પણ તમે અહીં કેમ પડ્યા ?’

જીવન છે તો શીલનો અભ્યાસ કરી લો. કુશીલ બન્યા તો અહીં ય ગઢા-ગઢી જેવા હાલ અને પરભવે તો સાક્ષાત્ એવા અવતાર ! અથવા નરકની ભક્તીમાં પડવાનું ! આ ખ્યાલ જાગતો છે. મહામૂલા શીલ ધર્મને બરાબર સાચવવાની બુદ્ધિ છે, એટલે સાહસ કરી જાનના જોખમે પણ કૂવામાં પડતું મૂક્યું. શરીર-સુખની ચિંતા અને પૈસાટકાની ચિંતા તો ગૌપણ; આત્માની ચિંતા મુખ્ય છે.

ચંદ્રસાર કહે છે, ‘હું તને લેવા માટે નીકળેલો એમાં ધનની કોથળી નોકરના હાથમાં રહી. એ બિચારાની બુદ્ધિ બગડી, ને અહીં મને ધકેલ્યો.

જિનવચનનું મહત્વ :- ધર્મ પાળવાની ભૂમિકા પ્રાપ્ત થાય એવો કાળ ચરમાવર્ત કાળ, મોક્ષ પામવા પૂર્વનો સંસારનો છેલ્લો પુદ્ગળ પરાવર્ત એ કાળમાં આવેલા જીવોને કાંઈ બધાયને પહેલવહેલાં જિનવચન નથી મળી જતાં, છતાં આત્મવાદી બીજા ધર્મ મળવાથી આત્મા તરફ દશ્ટિ જાય છે, દુઃખમય સંસારની ઓળખાણ થાય છે, પાપનો ભય પડ્ય લાગે છે, અને મોક્ષ માટે ધર્મ કરવાની લેશ્યા પડ્ય જાગી શકે છે. આમ છતાં જિનવચન નથી મળ્યા હોતાં એટલે આત્મા, સંસાર, મોક્ષ, સંસારના હેતુ, અને મોક્ષના હેતુ, આ બધાના સાચા સ્વરૂપનું ભાન નથી, તેથી વાસ્તવિક મોક્ષમાર્ગની સાધના હાથ નથી લાગતી.

બધું તર્કથી ન જણાય :- વાત પડ્ય સાચી છે કે જ્યાં સુધી સમસ્ત વિશ્વનું ત્રણેય કાળનું સંપૂર્ણ સવિસ્તર જ્ઞાન જેને નથી, પ્રત્યક્ષ નથી, ત્યાં સુધી એ અતીન્દ્રિય અને પરોક્ષ વસ્તુતાવ સંબંધી શું કહી શકે ? અને કહેવા જાય તો તેના પર વિશ્વાસ કેમ મૂકી શકાય ? બધી વસ્તુ કાંઈ તર્કથી નથી સમજાતી. એવા ઘણા પદાર્થ છે કે જે હેતુગમ્ય નથી, પડ્ય માત્ર આગમગમ્ય છે, અર્થાત્ સર્વજ્ઞ ભગવાનના વચનથી જ જાણી શકાય એવા છે. દા.ત. અમુક ડિયામાં અમુક જ વિધિ હોય એમાં બધે તર્ક નહિ ચાલી શકે. એમ લોકનો આકાર કેવો એમાં વિમાનો, પાતાળો વગેરે કેવા કેટલા, વગેરે ભાન તર્કના આધાર પર ન થઈ શકે. એવી રીતે આત્મામાં કેવા કેવા પરિણામ ઉપર કેવાં કેવાં કર્મ બંધાય છે એના સ્થિતિ-રસ કેવા અને કેટલા પ્રમાણમાં નક્કી થાય છે, એના પર પછી સંકમણ વગેરેની શી શી પ્રક્રિયા થાય છે. ઈત્યાદિ ઈત્યાદિ કાંઈ તર્કથી જાણી શકાય નહિ. એ તો સર્વદર્શા-સર્વજ્ઞાનીના વચનથી ખબર પડે. માટે જ જિનવચનની ગાંઠે બંધાવું જોઈએ.

જિનવચન પર શ્રદ્ધા :- આત્મચિંતાવાળાને આ ડર હોવો જોઈએ કે ‘મારામાં ધર્મની લેશ્યા હોવા છતાં રખે ને આપમતિએ કે અજ્ઞાનીના વચને હું ક્યાંક હિતને બદલે અહિતમાં ન પડી જાઉં ! માટે મારે તો જિનવચન એ જ પ્રમાણ. ભલે કદાચ જિનનું કહેલું બધું પાળી ન શકું,

પરંતુ એમાં તો મારી કમનસીબી માનું, બાકી માર્ગ અને તત્ત્વ, ગ્રાધ અને ત્યાજ્ય, વાચ્ય અને અવાચ્ય, વગેરે માનવાનાં તો જિનવચનના આધારે જ. દુનિયામાં બીજું તો ઘણુંય મળે છે, પણ જિનવચન ક્યાં મળે ?'

જિનવચનની ભાવના :- ત્યારે આજે તમને જિનવચન સહેજે મળી ગયેલ છે. એનું મૂલ્ય સમજો તો દેખાય કે એનો અભ્યાસ તો પછી, પરંતુ એટલું જો મનમાં આવે કે ‘અહો કેવું અનંત કલ્યાણનું સાધન જિનવચન ! કેટલા અલૌકિક સત્ય તત્ત્વોને કહેનારું જિનવચન !’ મહાસૂક્ષ્મ અને વિશાળ બુદ્ધિને ઘરનારા ગણધર મહર્ષિઓએ પણ એને અપનાવું ! મોટા દેવદેવેન્દ્ર જેવાએ ય એને તહેતિ કર્યું ! એના ગુણ ગાયા ! કેટલું ઉત્તમોત્તમ જિનવચન ! સકલ જગતના જીવોને અભ્યદાન કેવું અપનાવનારું ! ચક્રવર્તીપણું, સ્વર્ગ અને મોક્ષ સુધીનાં સુખ પમાડનારું, એકાંત હિતકારી, જીવનને ધન્ય કરનારું સફળ કરનારું... કેવું લોકોત્તર જિનવચન !...’ આટલું પણ જો ચિત્તમાં એકાગ્રભાવે આવે, તો પણ શાસ્ત્ર કહે છે કે એ ધર્મધ્યાન થાય, પાપ કર્માના થોક ઉડાવે, ગજબનાં પુણ્ય ઉપાર્જિત થાય. અલબત્ત વૈરાગ્ય ભાવનાથી ભાવિત થઈ જિનવચનની લોકોત્તમતા અને અનંત કલ્યાણ કરતાનો મનમાં અભ્યાસ કરવો જોઈએ.

પૂર્વના મહાન શ્રાવકોએ આ કરીને એની શ્રદ્ધામાં એટલા દઢ બન્યાના દાખલા છે કે દેવતા પરીક્ષા કરવા આવ્યા છતાં લેશ માત્ર ચલાયમાન થયા નથી. એમને જિનવચનનાં ઊંચા મૂલ્ય સમજાઈ ગયાં હતાં. મનને સચોટ લાગતું હતું કે હુન્યવી મહાન સિદ્ધિ-સમૃદ્ધિઓ જિનવચન રૂપી ખજાના આગળ કાંઈ જ વિસાતમાં નથી. ક્યાં એ ભવકેદમાં ફસાવી નાખનારી હુન્યવી સિદ્ધિ-સમૃદ્ધિઓ ! અને ક્યાં ભવોદ્વારક જિનવચન !’ એક મારક અને બીજું તારક. આટલો મોટો તફાવત છે. જિનવચન મળ્યું અને એને અથાગ શ્રદ્ધાથી હદ્યસ્થ કર્યું એટલે તો તાત્ત્વિક રીતે વીતરાગ બનવાનો પંથ હાથ લાગ્યો.

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

જિનવચન ભાવિતમતિ :- શાસ્ત્રોમાં શ્રાવકનું આ એક વિશેષજ્ઞ આવે છે કે એ જિનવચન ભાવિત મતિવાળા હતા. અર્થાત્ એમની મતિ, એમનો આશય જિનવચનથી ભાવિત કરાયેલો હતો. દવાની ભસ્મોને વનસ્પતિ વગેરેના પુટ આપી આપી ભાવિત કરવામાં આવે છે; એવી રીતે બુદ્ધિ, આશય, વિચારસરણીને જિનવચનથી ભાવિત કરેલી. એટલે તો હવે વિચારણા ચાલે તે જિનવચનના પ્રકાશથી ઉજ્જવલિત બનેલી ચાલે. બુદ્ધિ પર જિનવચનનું પાડું બંધન આવી ગયું.

આત્મચિંતાને જાગતી રાખવી હોય તો આ ખાસ કરો કે બુદ્ધિ ઉપર જિન-વચનનું પાડું બંધન આવી જાય. મન પર ભાર રહે કે ‘જિનેશ્વર ભગવાને કહું તે બધું જ સાચું અને શંકા વિનાનું.’ માટે મારે લેશમાત્ર પણ એની અવગણના નહિ કરવાની, જરાય બેપરવાઈ નહિ કરવાની, ક્યાંય વિચાર માત્રમાં જિનવચનથી વિરુદ્ધ ન ચિંતવાઈ જાય. કોઈ અભિપ્રાય જિનવચનથી વિરુદ્ધ બંધાય નહિ, એવી પાકી તકેદારી રાખવાની. પછી બોલવામાં તો પૂછવાનું જ શું ?

‘પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો,
ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો.’

આ મહર્ષિનું વચન છે. એટલે મુખમાંથી એકપણ ઉદ્ગાર જિનવચનથી અર્થાત્ શાસ્ત્રના અક્ષરથી વિરુદ્ધ મનમાની કલ્યાણનો કે મન માન્ય તર્કનો ન બોલાઈ જાય, એ ખાસ ચીવટ રાખવાની.

જમાલી એક પદ ઉત્સૂત્રનું બોલ્યો તો એનું ભવભ્રમજ્ઞ વધી ગયું, મરીચિએ પરિવ્રાજકપણામાં પણ ધર્મ એટલું ઉત્સૂત્ર ભાષણ કર્યું તો એક કોટાકોટિ સાગરોપમનો સંસાર વધી ગયો.

કમલપ્રભાચાર્યે તીર્થકરનામ કર્મ ઉપાજ્યું હતું. ભૂલમાં સાધ્યીનો સંધર્ષો થયો એના પર વિરોધીઓએ પૂછ્યું ‘સાધુથી સાધ્યીને અહાય?’ આચાર્યે પહેલાં તો બોલવાની છટાથી એમને ધુમાડ્યા, એનો સીધો ઉત્તર ન કર્યો. પરંતુ પેલા ક્યાં છોડે એવા હતા ? છેવટે ‘હા’ કે ‘ના’

નો સીધો જવાબ માર્ગ્યો ત્યારે આચાર્ય કહે છે ‘શાસ્ત્રમાં ઉત્સર્ગ-અપવાદ ઘણા છે તમને શી ખબર પડે !’

હવે જુઓ આમાં સાક્ષાત્ ઉત્સૂત્ર જેવું નહિ દેખાય પરંતુ દિલનો ભાવ શો હતો ? એ જ કે સામા એમ સમજે કે આ સ્ત્રીસ્પર્શ અપવાદના ઘરનો છે. ઉત્સર્ગ એટલે મુખ્ય નિયમ. અપવાદ એટલે એમાં કારણવશાત્ શાસ્ત્રને મંજૂર કરેલી છૂટ. આચાર્યે આ ઉત્તર કર્યો તે ભયંકર હતો; એણે કેટલાં જબરદસ્ત તીર્થ સેવા વગેરેના ભાવોલ્લાસથી ઉપાર્જલા તીર્થકર નામ કર્મને ખેરવી નાખ્યું ? એટલું જ નહિ પણ સાવધાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામ્યા અને સંસારમાં ભટકતા થઈ ગયા.

ક્યાં કીર્તિ અને ક્યાં શાસ્ત્રનાં બંધન :-

આનું શું કારણ ? કહો લજ્જા આવી કે ‘આવો મોટો હું આચાર્ય, અને ભૂલ્યો હું એમ કેમ દેખાડાય’ ? તેથી એ લજ્જામાં તણાયા, એમણે જડ કીર્તિની ચિંતા રાખી અને આત્મચિંતા ગુમાવી, તેમાં જિનવચનનો અવળો ઉપયોગ કર્યો. પોતાના આત્માનો એ ખ્યાલ ન કર્યો કે શાસ્ત્રવચનના અધિત્તિત ઉપયોગથી હું આ લોકોમાં કદાચ સારો દેખાઈ ગયો, પણ તેથી શું ? શાસ્ત્રના એક પણ અક્ષરના અવળા ઉપયોગથી મારા આત્માનું શું થાય ? મારે તે તુચ્છ લોકોની શાબાશીમાં રાચવાનું કે અનંત કલ્યાણકર જિનવચનને બંધાયેલા રહેવાના ? લોકની શાબાશી શું પરખાવે ? રાખ ને ધૂળ ! જિનવચનનાં બંધનનું પાલન તો મહાન પુણ્યાનુભંધી પુણ્યની પુષ્ટિ અને પાપકષયથી શુદ્ધિ આપે, ભવો સુધારી આપે. બસ, આ કાંઈ વિચાર ન રાખ્યો અને શાસ્ત્રીય વસ્તુમાં લોચો વાખ્યો તો ત્રણ જગતના પૂજ્ય બની શકવાની સ્થિતિમાંથી જગતના ગુલામ બનવાની સ્થિતિમાં મુકાઈ ગયા !

હઠવાદ પણ શાસ્ત્રને ઓળંગાવે :-

માત્ર લોકની શાબાશી લેવા શાસ્ત્રવચન ઓળંગે તો આ પરિણામ; એમ સમજતા નહિ, ખોટી હઠવાદે ચઢાય, પોતાને સ્થૂલ બુદ્ધિએ ઠીક લાખ્યું તેને સાચું ઠરાવવા શાસ્ત્ર-અક્ષરોને મચડવા-મરોડવામાં

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

આવે તો ય અધઃપતન છે. માથે ભાર તો એ જોઈએ કે ‘મારે તો જિનવચન એ જ મુખ્ય. મારી મતિને એના તરફ લઈ જવાની, પણ એને મારી મતિની પાછળ ઘસડવા ફાંઝાં નહિ મારવાનાં. સાંચું ઓછું વિચાર્યું હશે એનું એટલું નુકસાન નથી, જેટલું કહેવાતા સારા વિચાર માટે જિનવચનને તોડફોડ કરી આંદુંઅવળું લગાવ્યું હશે એમાં છે. શાસ્ત્રકારો સૂત્રના અનેક પ્રકાર કહે છે, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર વગેરે એનો એ રીતે જ ઉપયોગ કરાય. દા.ત. અપવાદસૂત્રનો ઉત્સર્ગ તરીકે ઉપયોગ ન કરાય. આંદુંઅવળું કરતાં તો જિનવચનના નામે એનું જ ઉલ્લંઘન થાય છે અને એ મહા અનર્થકારી છે.

જિનવચન ઓળંગવું ભયાનક કેમ ?

જુઓ કમલપ્રભાચાર્યના મહાન તીર્થકરનામકર્મના પુણ્યને પણ ઉથલાવી પાડે, ત્યારે એ જિનવચનનો વિપર્યાસ કરવાનું પાપ કેટલું જબરું ? એમ એ મરીચિને દીર્ઘકાળ સંસારમાં ભમાવે, અસંખ્ય વર્ષો સુધી જૈનધર્મથી વંચિત રાખે, જેન ધર્મનું દર્શન ન થવા દે, ત્યારે એ ઉત્સૂત્ર પાપ કેટલું જોરદાર ? ‘પાપ નહિ કોઈ ઉત્સૂત્રભાષણ જિસ્યો.’ એટલે જબરામાં જબરું પાપ ઉત્સૂત્ર, આ એમ જ થોડું લખ્યું છે ? દુરાચારાદિ પાપ કરતાં પણ જિનવચનને ઓળવવાનાં પાપમાં ચિત્ત ઘણું સંકિલણ થાય છે. પેલામાં તો હજ્ઞય કદાચ મનને ઊંઘતું હોય કે, ‘આ બહુ ખોટું થઈ રહ્યું છે ! ભગવાને સદાચાર ફરમાવ્યો અને હું આ શું કરી રહ્યો છું ?’ આવા જિનવચનનો મન પર ભાર તો રાખ્યો, પરંતુ ઉત્સૂત્રભાષણમાં તો એ જ ઉડાવવાનું થાય છે, ચિત્ત જિનવચનની સામે બળવો કરે છે, અને જિનવચનનો સામનો એટલે જિનનો, જિનના જ્ઞાનનો અને જિનની શક્તિનો સામનો ! એટલે એ કેટલો બધો ભયંકર નીવડે ?

જિનવચન પ્રેમીની ફરજ :-

એટલા જ માટે કહેવાય છે કે આત્મચિંતામાં માથે જિનવચનનું પાંકું બંધન જોઈએ; એવું બંધન, કે બીજી ગમે તેટલી પોતાની બુદ્ધિ

39

32

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

શક્તિ, તર્ક શક્તિ ને સ્હુરણા શક્તિ વગેરે હોય, છતાં એક વસ્તુ ચોક્કસ રાખવાની કે મારે જિનવચનની સીમા બહાર નહિ જવાનું. જિનવચન અટલે જિનવચન. ક્યાં એ અનંત જ્ઞાનીઓની નજરે જોયેલી વસ્તુ, અને ક્યાં મારે માત્ર કલ્પનાના ઘોડા દોડાવવાની વાત ! મોટા ગણધર ભગવંતો અને ચૌદ પૂર્વો જેવું કંઈસ્થ રાખી શકવાની મહાશક્તિ ધરાવનાર અથવા અદ્ભુત વિદ્વત્તાવાળા આચાર્ય મહારાજો પણ જો જિનવચનને બરાબર વળગીને રહે છે. પૂર્વચાર્યોના મતમાં બેદ દેખાય તો ‘તત્ત્વ ડેવલિગમ્બ’ કરે છે. તો પછી હું કોણ માત્ર ? જિનવચનથી, શાસ્ત્ર અક્ષરથી એક દોરાપુર આધા જવાય નહિ !

આપણા મનના માલિક કોણ ?

આ વિચારણામાં શું કર્યું ? જિનવચનની પરતંત્રતા સ્વીકારી લીધી, વચનના કહેનાર જિનેન્દ્રદેવની આધીનતા માથે ધરી લીધી. બહુ મજા છે આમાં. ‘હું તો જિનવચનને બંધાયેલો; જિનેશ્વર ભગવાન મારા મનના માલિક.’ આ ભાવના વારંવાર કરવામાં આવે, હદ્યના તાર જ્ઞાનાં એ રીતે કરાય, અંતરમાં એમ ભાસ્યા કરે કે ‘જિનવચન સિવાયના બંધનમાં શો માલ છે ? નાથ આરિહંતને છોડીને બીજા કયા માલિક મારું અજવાળી શકે એમ છે ? બીજાં બંધન અને માલિક તો પોકણ, ભવમાં ભટકતા રાખે એવા; ત્યારે જિનવચનના બંધન અને જિનેન્દ્રદેવ માલિક તો આ બીમ ભવસાગરથી પાર કરનારા !

વિષયના આવેશ કેમ તૂટે ! :- એમ હિલના દર્દ સાથે જિનવચનની ભાવના કરાય તો આત્મા ઉત્ખસિત થાય છે, મન ફોરું બને છે, અને વિષય-કષાયના આવેશ ઓછા થઈ જાય છે, કેમ કે જિનેશ્વર ભગવાનનું જીવન અને એમનાં વચન વિષય-કષાયને શત્રુ તરીકે ઓળખાવે છે. તો શત્રુનો આગ્રહ કેમ રખાય ? એનો આગ્રહ હોય છે માટે આવેશ ચઢી આવે છે. ‘મારે તો અમુક પ્રકારનું સ્વાદવાળું જ ભોજન જોઈએ’ એવો આગ્રહ હોય તો ત્યાં એ મળતાં એના પર આસક્તિનો આવેશ રહે છે. ‘કપડાં અમુક ફેશનનાં જ જોઈએ’ એવા આગ્રહ પર એ ઠઠારો

મળતાં આવેશવાળી આસક્તિ થાય છે. જો આગ્રહ ન હોય તો આસક્તિ થઈ જવા છતાં આવેશ નથી રહેતો; મન સમજે છે કે આ આસક્તિ ખોટી છે, નકામી છે, એમાં મારી નબળાઈ છે, મોટા ચક્કવર્તી કે દેવતાઓના ઠઠારા આગળ આની શી વિસાત છે કે એના પર લહેવાઈ જઈ આસક્તિ કરવી ?’ આ સમજ હોવાથી અવસરે કદાચ એ ન મળ્યું, યા એમાં કાંઈ ખામી ઊભી થઈ, તો એવી આકુળતા- વ્યાકુળતા નહિ થાય. ત્યારે આવેશ તો એવી ચીજ છે કે એની આગળ-પાછળ દશા જ જુદી જ્ઞાતની હોય છે. વ્યાકુળતા એની પૂર્વે અને પછી જડાયેલી રહે છે.

કષાયના આવેશમાં વધુ :- જિનવચનનાં બંધન નહિ, તો જેવી આ વિષયના આવેશમાં દશા, એવી કષાયના આવેશમાં. બલકે કહો કે કદાચ એથી પણ વધુ ભયંકર દશા ! જીવ સંસારી છે, રાગ-દ્રેષ્ટ થઈ જાય, ગર્વ-ગુસ્સો, મદ-માન-માયા- લોભ આવી જાય, પરંતુ એનો આવેશ હશે તો એ કષાયો રસપૂર્વક કરાશે ને એને વાજબી ઠરાવવાનું મન થશે. આવું હોય પછી પ્રસંગે પ્રસંગે એ કર્યા વિના કેમ રહેવાશે ? બીજાના સામે ન જોતા, જાત સામે જોજો કે ખાલી કષાય છે કે એનો આગ્રહ-આવેશ પણ છે ? કષાય કરવો પડે ત્યાં ભડક લાગે છે ? અભિમાન ઊછળી આવે કે રાગ-મમતા-તૃષ્ણા જળકી ઉઠે, ત્યાં ચોંકી ઊઠવાનું બને છે ખરું કે ‘અરે ! આ ક્યાં ચાલ્યો ? આમાં મારા આત્મા પર, કપડાં પર કાજળ પડે એની જેમ, કેવી મલિનતા થાય ? અનાદિથી તો મેલો દાટ થઈને આવ્યો છું, હવે અહીં મેલ ઉતારી નિર્મળ થવાનો ભવ અને સામગ્રી મળી તોય પાછો રાગ દ્રેષ્ટ-મદ- તૃષ્ણા કરી મેલ વધારવાનો ? આવી ચોકામજા થવી જોઈએ. એ થાય તો કષાયનાં ગાત્ર ઢીલાં પડી જાય; કષાય કરવા પહેલાં હોશ ન હોય, પછી હોશિયારી ન મનાય. મનને થાય કે ‘એવી હોશ-હોશિયારી તો જંગલના વાધ-વરુને કે રાક્ષસ-પિશાચને છાજે, મને નહિ.’

જિનવચનના બંધનમાં શું શું આવે ? :-

જિનવચનનું બંધન માથે ધર્યું; બીજું ગમે તે થાઓ પરંતુ મારા નાથના વચનની મારા દિલમાં રહેલી શ્રદ્ધાને જરાય ટક્કર ન લાગવી જોઈએ. એવું કાંઈ ન વિચારું, ન બોલું, કે ન આચરું જે જિનના વચનના વિરોધમાં જતું હોય, જે જ્ઞાનીઓએ બાંધેલી મર્યાદા, બતાવેલી પદાર્થવ્યવસ્થા; અને ઉપદેશેલા માર્ગ તથા અપેક્ષાઓને પ્રતિકૂલ હોય, એનો અપલાપ-ઈન્કાર કરનારું હોય, એ તો જોઈએ જ નહિ.' આવી રૂઢ જવાબદારી માથે ધરી, કિયામાં ઉતારી, એ એનું બંધન સ્વીકાર્યું અને અદા કર્યું ગણાય. ત્યારે અહીં એક પ્રશ્ન થાય છે,

પ્ર.-શું શ્રાવક પૃથ્વીકાયાદિ જીવોના આરંભ-સમારંભ અને પરિશ્રદ્ધ કરશે તે જિનવચને પાપનાં કારણ અને ત્યાજ્ય નથી કખા ? તો એ કર્યે જાય ત્યાં જિનવચનને માથે ધરવાનું ક્યાં રહ્યું !

શક્તિ અને પરિસ્થિતિ મુજબ આશાપાલન :-

ઉ.-આ પ્રશ્નનું સમાધાન એ છે કે જિનવચન માથે ધરવાની વસ્તુ કાંઈ માત્ર એક ઉત્કૃષ્ટ પ્રકારની જ હોય છે એવું નથી. એને સાંગોપાંગ આચરાય એ તો ઊંચી વચનબદ્ધતા છે. પણ એની નીચેની સ્થિતિમાં જિનવચનનો જ એક પક્ષપાત એ પણ એનું બંધન છે. સંપૂર્ણ આચરણ તો તાકાતના અભાવે ન પણ બની શકે. ભગવાને કાંઈ એવું નથી કહું કે 'શક્તિ ન હોય તો પણ ઊંચી ઊંચી ધર્મસાધના કરો જ, ગમે તે પરિસ્થિતિમાંય આચરો જ.' પ્રભુએ તો પોતાની શક્તિ અને પરિસ્થિતિને ઉચિત એવી સાધનાઓ ફરમાવી છે.

શક્તિનું ઉત્ત્વાંધન કરવા જાય તો પેલી કહેવત જેવું થાય, 'લાંબા વાંસે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય' ! અથર્તુ ગજ બહારનું કરવા જાય, તો મન બગડે, સમાધિ જાય, ચિત્તની-સ્વસ્થતા લોપાય, ઓલામાંથી ચૂલામાં પડવા જેવું થાય.

એમ પરિસ્થિતિને અનુચ્ચિત કરવા જાય તો ધર્મની નિંદા-લઘુતા થાય. ત્યારે સ્થાનને ઉચિત ભૂલવા જતાં આંતરિક ધર્મ ભાવનાને

ટક્કર લાગે. દા.ત. ગૃહસ્થપણામાં છે, અને વેપાર ધંધો ખટકાય જીવની સાક્ષાત્ કે પરંપરાએ વિરાધનાભર્યો છે. માટે એ ન કરતાં સામાયિક કરતો બેસી રહે, અને પછી આ આજીવિકા માટે ભીખ માગે તો એ પોતાના સ્થાનને અનુચ્ચિત ગણાય. લોક ટીકા કરે 'લ્યો જુઓ આમનો ધર્મ ! મફતિયું માગીને ખાવું છે !' એ ધર્મની લઘુતા થઈ ગણાય. એમ શક્તિ નથી અને મોટી તપસ્યા લગાવી છે, તો પછી ઢીલો પડતાં મનમાં લોચા વાળશે, આકુળવ્યાકુળ થશે. આ મન બગડ્યું કહેવાય. એમ સાધર્મિકનો સંયોગ છે ત્યાં વિચારવા બેસે કે એના માટે ચૂલો-ઓલો કરવામાં પાપ લાગશે, માટે મૌન રહો. ભોજનની વિનંતી નથી કરવી ! તો પોતે કંઈ સાધુ નથી, ગૃહસ્થ છે, છતાં સાધર્મિક ભક્તિનું કાર્ય ઉવેચ્યું એમાં મન બગડ્યું કહેવાય, દર્શનાચાર ગુમાવ્યો.

ધર્મની નિશાળના વર્ગો :-

પ્રભુનાં વચન હિસા-અહિસા, સાવધ-નિરવધ, વગેરેનો ભેદ સમજાવી એક ત્યાજ્ય, બીજું આદરણીય બતાવે છે. છતાં સાથે કક્ષા મુજબનો ધર્મ ફરમાવે છે. અનાદિના પાપના અભ્યાસી જીવને ધર્મ માર્ગ ચઠવામાં અનેક કક્ષા વટાવવી પડે છે. ધર્મની નિશાળનાં અનેક ધોરણ છે. કોઈ પહેલા ધોરણમાં હોય, કોઈ પાંચમામાં હોય. બધાય જીવો ધર્મમાર્ગમાં આવતાં એકદમ જ સૌથી ઊંચી કક્ષામાં નથી આવી જતા, ધીમે ધીમે આગળ વધે છે. એ હિસાબે એની કક્ષાને અનુસાર ધર્મસાધના શાસ્ત્રો કહી છે. એમાં એવું ય બને કે એક સાધના ઉપરની કક્ષાવાળા માટે ધર્મરૂપ ન હોય, એ નીચેની કક્ષાએ રહેલા માટે કર્તવ્ય ધર્મ તરીકે હોય, દા.ત. અરિહંતની દ્રવ્ય-પૂજા સાધુ માટે કર્તવ્ય નહિ, પરંતુ શ્રાવકપણે અવશ્ય કરણીય ધર્મ. કેમ કે પોતાની કક્ષામાં એ જ રીતે આગળ વધી શકે. નહિતર તો બીજા આરંભ-સમારંભ કરતો હોય અને દ્રવ્યપૂજામાં આરંભ છે, પુષ્પના જીવને કિલામળા થાય, એમ માની એ ન કરે એ અનુચ્ચિત ગણાય, એમાં પ્રભુ પ્રતેની કૃતજ્ઞતા

ગુમાવે ! ચિત્ત વિશુદ્ધિનું મહાન સાધન એળે જીય !

આરંભ-સમારંભ છતાં લાભની દસ્તિ :- ધરકામ આવ્યું ત્યાં કહે છે, ‘એ તો આરંભ-સમારંભ કરવા પડે.’ અને જિનભાક્તિ, સાધર્મિક ભક્તિની વાત આવી ત્યાં કહે છે ‘એ ન કરાય.’ આ કેવો ન્યાય ? તો પછી ઊંચો શી રીતે આવીશ ? એ કરીને પણ લક્ષ્મીની મૂર્ખ્ય ઉતારવાની છે, ફૂતજ્ઞતા બજ્ઞવવાની છે, હૈયાના ધર્મગ્રેમને સક્રિય કરવાનો છે, ગુણની સક્રિય અનુમોદના-હર્ષ વ્યક્ત કરવાના છે. એ બધું, ભક્તિ ટાળીને, શી રીતે કમાવાનો ? તારી કક્ષા જ એવી છે કે એમાં એ રીતે ઊંચા અવાય, ધર્મ પરિણામની વૃદ્ધિ થાય, નહિતર તો મોહ-મૂર્ખ્ય વગેરે અકંબધ રહી જીય. બાળકની કક્ષા જ એવી છે કે વગર સમજયે પણ ગોખીને ઊંચો આવે. ત્યાં જો દલીલ કરવા જીય કે ‘સમજયા વિના ગોખેલું શું કામનું ? હું તો સમજ પડ્યા પછી ગોખીશ’ તો આગળ વધી શકે ? આગળ નહિ ઠોઠ રહી જીય.

તેરાપંથી, સોનગઢપંથી વગેરે કક્ષા મુજબની ધર્મમયદાને...સમજતા નથી, એટલે બિચારા ખરેખર ધર્મ પરિણામથી વંચિત રહી જીય છે. બાવાના બેય બગડે છે. (૧) ગૃહસ્થપણે રહી સદાચારોનું સહર્ષ પાલન કરી શકત તે ગયું, અને (૨) બાવો બન્યા પછી હવે ચિત્ત ઠેકાણે રહેતું નથી. તેથી વલખાં મારે છે, અનેક કુવિચારોમાં અટવાયા કરે છે. અને એય કેટલું ચાલે ? એનો ધસારો વધી જતાં કાયાથી ય આહુંઆવળું કરે છે, તેમ પાછો એના પર કોઈ ખેદ-ઘૃણા અનુભવતો નથી. ઉલટું ‘સર્વ બ્રહ્મમય’ કરી મસ્તી અનુભવે છે. આમ આત્મિક દસ્તિએ જોતાં બાવાના બેય બગડે છે. એવી દશા આ પ્રભુ પૂજા-દયા દાનમાં હિસા અને અધર્મ માનનાર તેરાપંથી, તથા ધર્મ કિયામાં મિથ્યાત્વ માનનાર સોનગઢ પંથીની થાય છે. એમને બિચારાને એ ખબર નથી કે ધર્મ એ કક્ષા મુજબનો હોય છે. ને ભિન્ન ભિન્ન કક્ષા જ એવી છે કે એમાં એક જ રીતનો વિકાસ માર્ગ ન હોય. નિશાળમાં જુવો, એક ઈતિહાસ પણ ઉપરના વર્ગમાં જુદી જુદી

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

રીતે ભણાવે છે. કક્ષાનુસાર આરાધના કરે તો જીવ આગળ વધી શકે, નહિતર નીચે ય પટકાઈ જીય.

આ ઉપરથી એ સમજવાનું છે કે જિનવચન કક્ષાનુસાર ધર્મ સાધનાનો ઉપદેશ કરે છે. તેથી ગૃહસ્થ કાંઈ ઉપરની કક્ષાની ધર્મ સાધના ન કરી તેથી એ જિનવચનને ઓળંગનારો ન કહેવાય. ઉપરની સાધના ન કરે એટલું જ નહિ કિંતુ પોતાની કક્ષાની ધર્મસાધના કદાચ ન બજ્ઞવી શકે, છતાં જો ‘એ જ કર્તવ્ય છે, કિંતુ પાપ એ કર્તવ્ય નહિ’ તેમજ એ ધર્મસાધના કરીને પણ ઉપરની કક્ષાની ધર્મ સાધનાએ જવાનું છે, એ જ કર્તવ્ય છે. એવી જિનવચન પર અથાગ શ્રદ્ધા ધરે અને કર્તવ્ય ન બની શકવાના પર તથા થઈ જતા પાપ પર ખેદ ધરે તો પણ તે જિનવચનને માથે ધરનારો કહેવાય, જિનવચનનાં બંધન સ્વીકારનારો ગણાય.

આ વસ્તુ વ્યવહારમાં દેખો દા.ત. બાપનો આદેશ છે કે ‘આપણે એવી આવક નથી, માટે ખર્ચ ઓછો રાખવો.’ હવે દીકરો માંદો પદ્ધ્યો, અને ઉપચાર માટે સારા વૈઘની દવા વગેરે લેવું પડે છે, ત્યાં ખર્ચ વધુ થાય છે, તો શું એ બાપના આદેશને બંધાયેલ રહ્યો કે ઓળંગનારો ? ઉલ્લંઘન કરનારો નહિ ગણાય; કેમ કે એના સંયોગ એવા છે કે ખર્ચ કરવો પડે.

જિનવચન-સ્વીકારવામાં પાપ ઓછામાં ઓછું :-

એમ અહીં પણ મારંબની અવસ્થાવાળા જીવને મોહનો મંદવાડ છે, તેથી આરંભ વિષય પરિગ્રહના એ પાપ થઈ જીય છે; તો એટલા માત્રથી એ જિનવચનને ઉત્થાપનારો નહિ ગણાય, અલબંત એના દિલમાં બેઠેલું જોઈએ, કે

આ આરંભ-વિષય-પરિગ્રહ એ બધાં પાપ છે, એવાં પાપોથી ભર્યો ધરવાસ એ ફાંસલો છે. આત્માનો મોક્ષ કરવો હોય તો ધરવાસ તથી સર્વથા પાપરહિત સાંધુ જીવનું એ જ એક ઉપાય છે. એ ન બની શકે ત્યાં સુધી પણ એની તરફ જવાના ઉદ્યમ તરીકે પાપમાં

૩૮

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

ઓછાશ કરવી પડે અને થઈ જતાં પાપનો પક્ષપાત નહિ પણ અરુચિ-ધૂળા જોઈએ. જિનવચનની બલિહારી છે. એણે આ પાપો અને ઘરવાસની સાચી ઓળખાણ કરાવી. છૂટવાના માર્ગ બતાવ્યા !' ઓછામાં ઓછું, આવી અંતરમાં જાગૃતિ હોવી જોઈએ. તો એ જિનવચન સ્વીકાર્યું કહેવાય. પછી ત્યાં એ ભય નથી કે 'તો પછી એ રંગરાગ બેલતો રહેશે !' ના, જિનવચન સ્વીકારનાર તો પાપ પ્રત્યે તિરસ્કારવાળો હોય છે, તેથી પાપમાં નિરાંત કરીને બેસી રહેનારો હોય નહિ. અને તો અવરનવર ચણવળાટ થતો હોય, નિષ્પાપ જીવન માટે એ તલસતો હોય, જિને કહેલાં તત્ત્વોની અખૂટ શ્રદ્ધા છે, હેય-ઉપાદેયના વિવેકવાળો હોય. 'હેય એટલે ત્યાજ્ય એવા આશ્રવોનો ત્યાગ કરી, ઉપાદેય એટલે કે આદરણીય સંવર માર્ગને અપનાવી, જિનેશ્વર દેવને ઊંચું જીવન સમર્પણ કેમ કરું,' એ જંખતો હોય. આવો આત્મા વિષયોના રંગરાગમાં નિરાંત શેનો અનુભવે ? આંધળો કેમ બને ?

ત્રણ આવેશ પર આપમતિ :-

આત્મચિંતા જાગ્યા પછી તો આત્માના શત્રુભૂત વિષય-કષાયોને એ જ રીતે ઓળખે નવાજે; અને આગળ વધી જિનશાસન ગ્રાપ્ત કરવા મહાભાગ્યશાળી બન્યો હોય તો તરણતારણ જિનવચનને પરમ કલ્યાણકારી તરીકે સ્વીકારે ત્યાં એનું બંધન માથે ધર્યા પછી આપમતિપણાને દેશવટો દેવાઈ જાય. મનને થયા કરે 'હું અખૂટ શું જાણું, શું સમજું ? એ તો વીતરાગ-સર્વજ્ઞ ભગવાને કહ્યું તે જ સાચું તે જ મારે ગ્રાદ્ય, માન્ય અને આદરણીય. મારી ચામડાની આંખે દેખીને કલ્પાતી મતિના ભરોસા નહિ; ભરોસા તો વીતરાગનાં વચ્ચના' આમ જિનવચનને જ બહુ માને, અને વિષય, કષાય કે અજ્ઞાનના આવેશ પર ઘડાતી-સર્જતી પોતાની મતિને તુચ્છ લેખે. આપમતિ આ ત્રણ પૈકી કોઈ ને કોઈ આવેશ પર ઘડાય છે.

મોક્ષ માર્ગની આરાધના જિનવચનનાં બહુમાન અને આપમતિની અવગણનાથી શરૂ થાય છે. આત્મચિંતા અહીંથી ખરો આકાર લે છે.

આર્થ દેશના બીજા આત્મવાદી અને મોક્ષવાદી ધર્મમાં અવાય ત્યારે પાપનો ભય અને ધર્મબુદ્ધિ જાગી શકે છે, તેમજ તે આત્મચિંતાના પાયા ઉપર પણ ઊભા થઈ શકે છે, કિન્તુ સર્વજ્ઞનું આલંબન હજી મળ્યું નથી, એમનાં જીવ અને જગતના યથાર્થ સ્વરૂપને કહેનારાં વચ્ચન નથી મળ્યાં, એટલે વાસ્તવિક આત્માની ચિંતા આવી નહિ ગણાય. આનું કારણ જુઓ.

વીતરાગ-સર્વજ્ઞ ભગવાનને આત્મા જો બંધાયેલો નથી, તેમજ સર્વજ્ઞ વચ્ચનને બુદ્ધિ જો બંધાયેલી નથી, તો કાં આત્મા સ્વચ્છં છે, અને બુદ્ધિ સ્વૈચ્છિક છે. માત્ર જાત પર નિર્ભર છે. અથવા કોઈ અજ્ઞાની અને એનાં વચ્ચનને પનારે પડી છે. એટલે એ નિર્ભય નથી; સાચા માર્ગ નથી. આપમતિ, અધૂરીમતિ, અવળીમતિ એ ભયસ્થાન છે; એના પર શો ભરોસો મૂકી શકાય ?

એક જ વેદ પર ફાંટા ઘણા :-

અસર્વજ્ઞનાં દર્શનમાં પદાર્થ નિરૂપણ ઘણું અધૂરું અને એકાંગી છે, તેમજ જે છે તે કલ્પનાના પાયા પર છે; મૂળમાં પ્રત્યક્ષથી તત્ત્વદર્શન નથી. એટલે અધૂરું ને વિપરીત હોય એમાં નવાઈ નથી. આત્મા વગેરે પ્રત્યક્ષ ન હોય તો સૂક્ષ્મતાથી શું કહી શકે ? મિથ્યાદર્શનનાં અધૂરાં અને વિપરીત તત્ત્વ પકડ્યા પછી ખૂબી એ થાય છે કે સાપકની જિજ્ઞાસા પૂર્ણ થતી નથી, તેમ સ્પષ્ટ ખુલાસો નથી થતો, કેઈ વાંધા અને અધૂરાશ દેખાય છે એટલે પછી પોતે એમાંથી રસ્તો કાઢવા મનમાન્યા તરીકે ચલાવી વિસ્તાર કરવા મથે છે. પરિણામ એ આવે છે કે એક જ શાસ્ત્રને માનનારામાં કેટલાય ભેદ અને ફાંટા પડે છે. દાખલા તરીકે જુઓ કે વેદશાસ્ત્ર એ જ, પણ એને માનનારામાં વેદાન્તી, મીમાંસક, નૈયાચિક, વૈશેષિક વગેરે કેટલાય ભેદ છે. પાછા એ સિદ્ધાન્તો બાંધવામાં સામસામા આવીને ઊભા રહે છે. વેદાન્તી કહે છે આત્મા એક જ છે, ન્યાયવાળો કહે છે અનેક છે. મીમાંસક કિયાકંડ ને જ મુખ્ય કહે છે, ત્યારે ન્યાય-વૈશેષિક તત્ત્વજ્ઞાનની જ

મહત્ત્વ માને છે.

જુદાં જુદાં દર્શનોનું કારણ :-

એ જ વેદશાસ્ત્રને માનનારા છતાં એમનાં તત્ત્વ, સિદ્ધાન્ત, અને આરાધના માર્ગમાં કેટકેટલા બેદ પડે છે. કેવું નાટક ! શાથી આમ ? કહો, વેદશાસ્ત્ર સર્વજ્ઞક્ષિત નથી, એટલે અધૂરું, અસ્પષ્ટ અને વિસંવાદી દર્શન કરાવે છે. પછી એને અનુસરનારને તર્ક અને કલ્પનાનો આશરો લેવો પડે છે. કહે છે ને કે મૂર્તિ મૂર્તિ મતિર્લિન્ના-પોતપોતાની મગજશક્તિ, વલણ, અભિપ્રાય વગેરેના આધારે તર્ક અને કલ્પના કરવાનું બનવાનું અને જગતમાં કુતર્ક ઘણા, કુકલ્પના ઘણી, એટલે જુદા જુદા નિર્ણય બાંધવાનું થાય એ સહજ છે; પરસ્પર વિરોધમાં ઊભા રહેવાનું થાય એ સ્વાભાવિક છે. એમ કલ્પનાના જોર પર જુદાં જુદાં દર્શન, ઈષ્ટદેવ અને ધર્મો ઊભા થાય છે.

વેદશાસ્ત્ર અનું એ માનવા છતાં પરસ્પર વિરોધમાં ઊભા રહેવાનું કારણ શું ? આ, કે એ શાસ્ત્રોના કહેનાર સર્વજ્ઞ નથી, તેથી આપમતિએ તર્ક-કલ્પના કરી ચાલવું પડે છે. પોતાની જાતને માનશે કે ‘હું વેદનો અનુયાયી છું. વેદ કહે એ જ પ્રમાણ,’ પરંતુ ખરી રીતે તો આપમતિનો અનુયાયી બને છે. એક જગ્યાએ જો સીધેસીધું માન્યું કે ‘બ્રહ્મસત્યં જગન્નિષ્ઠા,’ પછી આગળ આવ્યું કે ‘પૃથ્વી દેવતા, આપો દેવતા,’ તો ત્યાં સ્વમતિએ કલ્પું કે આ ઔપચારિક વાત છે, કેમ કે જગારે એક શુદ્ધ આત્મા એ જ તત્ત્વ છે ત્યારે પૃથ્વી, પાણી વગેરે તાત્ત્વિક હોઈ શકે નહિ ! ત્યારે બીજો કહે છે કે ‘પૃથ્વી વગેરે તો પ્રત્યક્ષસિદ્ધ સાચાં તત્ત્વ છે, કલ્પનામાત્ર નથી, એટલે ‘જગન્ન મિથ્યા’ નો અર્થ એ કે આ લલચાવનારા જગત પર ભરોસો મૂકવા જેવો નથી.’

મિથ્યામાર્ગને મૂળ આપમતિ કેમ ? :-

આમ બેય જ્ઞો સામસામી દિશામાં ઊભવાનું કર્યું, એ કેવીક વિટંબણા ? પણ એ શાથી ? સ્વમતિએ ચાલવાનું કર્યું માટે. પાયામાં એ ન જોયું કે ‘જરા ઊભા રહો, આ શાસ્ત્રના કહેનારા કોણ છે ?

પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, એવું જગતમાં દેખાય છે. તો અહીં એવા વક્તા પુરુષ જાગ્રવા ન મળે તો આગળ કેમ ચલાય ? ગમે તેનાં કહેલાં શાસ્ત્રના આધારે કેમ રહેવાય ?’ પણ ના, આ કાંઈ જોયું નહિ, મનને બેહું કે આ શાસ્ત્ર સાચું છે એટલે એને અપનાવી લીધું. એનો અર્થ જ એ કે મૂળમાં આપમતિએ ચાલ્યો પછી તો આગળ ઉપર એ શાસ્ત્રના પરસ્પર વિરોધી કે વસ્તુસ્થિતિ સાથે વિસંવાદી વચન મજ્યાં તો આપમતિએ એની ઘટના કરી અને આપમતિના આધાર પર તત્ત્વવ્યવસ્થા, સિદ્ધાન્ત વ્યવસ્થા અને સાધના માર્ગની વ્યવસ્થા ગોઠવી, પછી ભલે એમાં શાસ્ત્ર વચનને મરોડવા પડ્યા, મચડવા પડ્યા ! એટલે કહી શકાય કે મિથ્યાશાસ્ત્રના અનુયાયી બનવા છતાં મૂળ આપમતિ જ કામ કરી રહી છે, અને અજ્ઞાનીની આપમતિ ક્યાંથી સીધે રસ્તે લઈ જાય ?

જૈનશાસને જ આપમતિ ટાળવા પર ભાર મૂક્યો છે :-

જૈનદર્શન અને ઈતર દર્શનોમાં આ એક ફરક પડે છે કે અહીં સર્વજ્ઞની મતિ અર્થાત્ મતને અનુસારે ચાલવાનું બને છે, ત્યારે ઈતર દર્શનોમાં સ્વમતિએ હંકારવાનું થાય છે. એટલે મૂળમાં જ વાંધો ! એક માત્ર જૈન દર્શનમાં જ સમ્યગ્દર્શનને મોક્ષમાર્ગનો પાયો કહ્યો છે, સમ્યગ્દર્શન એટલે સર્વજ્ઞનાં વચનની વફાદારી, જિનવચનને બંધાયેલા રહેવું, આપમતિ બાજુએ મૂકવી. આ વસ્તુ પાયામાં જરૂરી હોવાનું જૈનધર્મ જ કહે છે. બાકી કોઈ દર્શનમાં સમ્યગ્દર્શનને મોક્ષમાર્ગ કહ્યો નથી. ત્યાં તો તત્ત્વજ્ઞાનને મહત્વ આયું. કિયા, વૈરાગ્ય, ભક્તિ, તપસ્યા વગેરે વગેરે સાધન માન્યાં, પરંતુ સમ્યગ્દર્શન નહિ. ‘વેદાઃ પ્રમાણમ્’ વેદશાસ્ત્ર એ પ્રમાણભૂત છે એમ કહે ખરા પરંતુ એના અર્થ કરતી વખતે અને માર્ગ નક્કી કરવા ટાજો તર્ક અને કલ્પના પર અર્થાત્ સ્વમતિ-સ્વાભિપ્રાય પર દોડવાનું બને છે.

આપમતિ એ સંસારનું મૂળ કારણ છે :-

આનું પરિણામ શું આવે ? એ જ કે સંસારી જીવ અનાદિકાળથી

મિથ્યા આપમતિ પર ચાલી ચાલીને તો આંધળાની જેમ આ સંસારરૂપી અટવીમાં આથડતો રહ્યો છે, ને હવે ધર્મના નામ પર પણ આપમતિએ ચાલવાનું કરવાથી એ જ ભવાટવીમાં ભટકતા રહેવાનું થાય છે. અજ્ઞાની અને આંધળો બે બરાબર. માત્ર આંધળાને આંખે દેખાય એવી ચીજ ન દેખાય, ત્યારે અજ્ઞાનીને જ્ઞાનીઓના જ્ઞાને દેખાતી વસ્તુ, અતીન્દ્રિય વસ્તુ નથી દેખાતી. હવે જો એ કોઈ દેખતાનું આલંબન ન પકડે તો દાવાનળ લાગેલા વનવગડાની વચ્ચે આંધળાની જેમ સળગી જ મરે કે બીજું કંઈ ? એ તો જ્યાં સુધી પોતે પૂરો દેખતો નથી થયો ત્યાં સુધી કોઈ સારાં દેખનારના હાથમાં દોરી સોંપે, એના કથા પ્રમાણે ચાલે, તો જ બચી શકે.

માટે જૈનધર્મ પહેલું આ કરવાનું કહે છે,

કે સમૃદ્ધશન ધારણ કરો. જગતના ગૂઢ ભાવો સર્વજ્ઞ ભગવાન જ સંપૂર્ણપણે પ્રત્યક્ષ જુએ છે, તો ‘એ કહે એ જ પ્રમાણ, એ જ સાચું અને શંકા વિનાનું’ એવી દઢ શ્રદ્ધા પહેલી ઉભી કરો. સર્વજ્ઞના વચનને બંધાયેલા રહો, એનાં પાકાં બંધન માથે ધરો, પછી શક્તિ પ્રમાણે એમણે કહેલા દયા-દાન, પ્રતિ-નિયમ, જ્ઞાન-ધ્યાન-કિયા વગેરે આચારો. જો પાયામાં સર્વજ્ઞવચનની વફાદારી, વચનનાં બંધન માથે નહિ ધર્યા હોય તો ગોજારી આપમતિ ઉભી રહેશે, આપમતિની દખલ દયા, દાન વગેરે ધર્મકિયામાં પણ આવશે. અને ધર્મની મહેનત માથે પડશે.

ધર્મકિયામાંય આપમતિની દખલ :-

તમે કદાચ પૂછુશો કે એવું કેમ ? ઉત્તર એ છે કે આપમતિનાં અપલક્ષણ એવાં છે. અજ્ઞાનતાને લીધે પૂરી ખબર છે નહિ, અને જિનવચનનું બંધન માથે રાખ્યું નથી, એટલે દયા-દાન વગેરે ધર્મના આચારો મનમાની રીતે થશે. ‘તો ભલે થાય, પણ થશે તો દયા દાન જ ને ?’ એમ નહિ કહેતા, કેમ કે વિવેક નહિ હોવાથી કદાચ દયાને નામે હિસા કરશે, અને દાનના નામે પાપનાં પોખજા કરશે. ઈતરોમાં જુઓ ગાયનાં દાન કરે છે એ શું છે ? ગાયને તો ગુલામી જ ને ?

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

૪૩

અથવા બિલાડીને પાળી દ્યાથી દૂધ પાય અનું પરિણામ ઉદરની હિસામાં જ ને ?

પણ ઈતરની શી વાત કરો ? અહીં પણ આપમતિથી પૂજા-સામાચિક કરે એમાંય કઈ દશા ? મન ફાવે એ રીતે એ થવાનું એમાં પાપ વિચારો પણ કોઈ જ ડર વિના ચાલવાનો સંભવ. એમ એવું પણ બને કે સામાચિકમાં ભળતું જ પુસ્તક વાંચશે કે ભળતી જ વાતોચીતો યા પાપના આદેશ કરશે ! એવું દેરાસરમાં પેઠા પછી પણ પાપની વાતોમાં પડવાનો સંભવ. તાત્પર્ય, જો વચનનાં બંધન નથી તો આપમતિએ ધર્મના ધરમાં વિરાધના, આશાતના કે પાપવૃત્તિ ચાલવા સંભવ ઘણો.

આપમતિનાં યથેચ્છ જજ્ઞમેન્ટ :-

આપમતિની અવળચંડાઈ જો ધર્મકિયામાંય ચાલતી રહે તો સાંસારિક જીવનમાં પૂછવાનું શું ? આજે દેખાય છે ને કે ધર્મના બોરનું બીટ ક્યાં છે એ ખબર નથી છતાં સીધા જજ્ઞમેન્ટ ફાડ્યા કરે છે કે ‘ફલાણું તો આમ જ છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે.’ ત્યાં એને ઉત્સૂત્રભાષણના મહાપાપનો ડર છે ? દેવ-ગુરુનો અનાદર, અવગણના થઈ જવાનો કોઈ ભય ખરો ? બાકી આપમતિના દુરાગ્રહવાળાનાં વિચાર-વાણી-વર્તાવ લોકમાં પણ નિદાય એવાં બને છે. કુટુંબમાં પણ એને સદ્ગ્રાવ મળવો મુશ્કેલ બને છે. તેમ આપમતિમાં તણાયો વ્યાપારાદિમાં નુકસાનનો પણ ભોગ બને છે. એને સારાની સલાહ ખપતી નથી. એને તો પોતાની મર્યાદિત બુદ્ધિ પર નિર્ણય બાંધવા છે.

જિનશાસનમાં જિનાણા : ગુર્વાધીનતાનું મહત્વ :-

જીવનો મોટો દોષ આપમતિ-સ્વચ્છંદતા છે. હજુ સામાન્ય રૂપની આત્મચિંતા ય જાગે, દાન પણ દેશે, શીલ પાળશે, પ્રતનિયમ, ત્યાગ, તપસ્યા બધું કરશે, પરંતુ આપમતિ છોડવી મુશ્કેલ પડે છે, જિનવચનને અક્ષરશ: બંધાયેલા રહેલું ને જિનવચનાનુસારી ગુરુને આધીન રહેલું મુશ્કેલ પડે છે. સંસાર છોડી સાધુ બન્યા પછી પણ જીવને આ મોઘું

૪૪

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

પડે છે માટે તો શાસ્ત્રો જિનાજ્ઞા અને ગુર્વજ્ઞાને બંધાયેલા રહેવા પર ખૂબ ભાર મૂક્યો. એના ઉપદેશનાં પાનેપાનાં ભરેલાં છે. એની સ્ખલનાના મોટા દંડ બતાવેલા છે; અને એને બંધાયેલા ન રહેનારની ગમે તેવી બીજી કષ્ટમય તપસ્યા વગેરેને પણ કુલટા નારીના ઉપવાસ જેવી તુચ્છ અને આત્મવિટંબણા કહી છે.

વિચારવા જેવું છે કે આત્મચિંતા તો જાગી છે, આત્મહિત કરી શકે એવી તપસ્યા, વ્રત-નિયમ, શાસ્ત્ર-વ્યવસાય વગેરે પણ કરે છે. છતાં આત્મવિટંબણા થાય એ કેટલી કરુણાસ્થિતિ ! તે પણ આ એક જ કારણો કે જિનાજ્ઞા અને ગુર્વજ્ઞાને બંધાયેલા રહેવું નથી. આમ તો કરવું છે બધું પણ આપમતિ પર, પોતાને ઠીક લાગે એ રીતે.

આપમતિ એ ક્ષેત્રરોગ છે.

જ્ઞાની ભગવંતો જાણે છે કે જીવમાં આ આપમતિનો ભયંકર રોગ છે, ક્ષેત્રરોગ છે, અર્થાત્ એક ખેતરમાં જેમ અનેક પાક થાય એમ આ આપમતિના રોગની ઉપર બીજા અનેક દોષ-દુષ્કૃત્યો રૂપી રોગ ઊભા થાય છે. એવી અનંતાનંત કાળની આપમતિની પકડમાં ફસાયેલા જીવની આ ભવાટવીમાં ભારે દુર્દશા થતી જોઈને અને એની મૌલિક રોગ-રૂપતા પરખીને ‘ધર્મો આણાએ પડિબદ્ધો’ ધર્મ જિનાજ્ઞા સાથે સંકળાયેલો છે એ પહેલું સૂત્ર બાંધ્યું. ધર્મો અહિસાએ પડિબદ્ધો, ધર્મો તવસ્સ પડિબદ્ધો, એવું ન લઘું પણ આણાએ પડિબદ્ધો લઘું. એનું મહત્વ સમજાય છે ? આ છે કે એથી આપમતિનો ક્ષેત્રરોગ ટાળો. પછી બીજા રોગ મટટાં વાર નહિ લાગે.

‘ઘટકુટ્યાં પ્રભાતમ્’ મિયાં ડેરના ડેર :-

ત્યારે જુઓ કે શું અનંતા કાળમાં કઠોર તપસ્યાઓ નથી કરી ? વનવાસ નથી સેવ્યાં ? શ્રાવક અને સાધુપણાની કિયાઓ નથી કરી ? બધું કર્યું છે, પરંતુ મિયાં ડેરના ડેર ! ‘ઘટકુટ્યાં પ્રભાતાં’ પુલ પરથી જવા માટે એક પૈસો ટેક્ષ આપવો પડે, માટે મિયાં ક્યાંય બીજે નદીમાંથી માર્ગ કાઢી લેવા ઊપડ્યા ! આખી રાત ભમ્યા, પરંતુ

ભમતાં ભમતાં પ્રભાતે જેવું તો પાછા ટેક્ષવાળાની નાકા પરની ઓરડી પાસે આવી ઊભા ! ચાલ્યા તો ઘણું પરંતુ અંતે ડેરના ડેર.

એમ, અહીં એક આપમતિ ન છોડી, જ્ઞાનીનાં બંધન ન સ્વીકાર્યી, અને ત્યાગ, તપસ્યાઓ ઘણી કરી, દેવલોક પણ દેખ્યા, છતાં સરવાળે આજે પણ જીવ હજુ એ જ ભવમાં ફસેલો છે એ હકીકત છે. એટલાં બધાં ધર્મકષ્ટ ઊઠાવ્યાં છતાં કેમ આમ ? એક પૈસાના બચાવ ખાતર યાની આપમતિ ન છોડવા પર. આપમતિ છોડી આજ્ઞા મુજબ વર્તવામાં કષ્ટ વધારે છે એવું નથી, કેમ કે જીવે ભૂતકાળમાં ભગીરથ કષ્ટો તો ઊઠાવેલા છે.

આપમતિનાં કારણ :-

પ્રશ્ન રહે કે ત્યારે આપમતિ કેમ છોડી નહિ ?

ઉત્તર એ છે કે એની પાછળ અહંત્વ, માનાકાંક્ષા, પૌદ્રગલિક સ્વાર્થલાલસા, અજ્ઞાન,... એવાં કારણ કામ કરતાં હોય છે.

(૧) અહંત્વના આકાર : આપમતિની પકડ :-

સંસારરૂપી ઈમારતના પાયામાં અહંત્વ એ મહત્વનો ભાગ ભજવે છે. અહંત્વ પાછળ માણસ મરી પડે છે.

‘મને આ ઠીક લાગે છે, અને તે જ બરાબર છે...’

‘હું ખોટો નથી.’ ‘હું એવી ભૂલ ન કરું’ ‘મને કેમ પૂછતા નથી ?’

‘મારી માન્યતા બરાબર છે.’ ‘મને કેમ બોલાવ્યો નહિ ?...’

આવી વૃત્તિમાં અહંત્વ કામ કરી રહ્યું છે અને આની પકડ છૂટવી બહુ મુશ્કેલ છે, કેમ કે અનંતા કાળ એના અભ્યાસ કરેલા છે. એ પકડમાં આપમતિ ન છૂટે એ સહજ છે.

(૨) માનાકાંક્ષાથી આપમતિ :-

ત્યારે માનાકાંક્ષા પણ જીવને એવી સત્તાવે છે કે જે આપમતિનો ચાળો કરાવે. દા.ત. માણસને એમ ઊલટ-હોંશ થાય કે ચારમાં હું સારો કેમ દેખાઉં ! એટલા માટે જ્ઞાનીઓના વચ્ચના રાહ મૂડી એ પોતાની હોશિયારી અને બુદ્ધિબળ ઉપર નવા નવા તુકા લગાવે છે.

શાસ્ત્ર સાથે વિરોધ આવે એવા સિદ્ધાન્તો ઘડે છે. લોકોને એવા સાધના માર્ગ બતાવે છે. એમાં લોકોનું આકર્ષણ થતાં એવી શાસ્ત્ર બાધ્ય પ્રરૂપણ અને પ્રવર્તન દબડાવે રાખે છે ! આ શું છે ? આપમતિના ચાળા.

વર્તમાનમાં ચાલતા એક મત અંગે એવું સાંભળ્યું, કે એના સ્થાપકને પહેલાં તો એમ લાગ્યું કે ‘મને લાગે છે તે જ સાચું છે.’ બસ એના પર આપમતિમાં ચડી મત પ્રવર્તાવ્યો, પછી આગળ જતાં એવું બન્યું કે ડાખા માણસોએ એમને સમજાવ્યા, પછી એ મત મૂકી દેવા તૈયાર પણ થયા. કિંતુ ત્યાં તો એમના નવા ઊભા કરેલા અનુયાયીઓ કહે ‘મહારાજ હવે આવું કાં કરો ? હવે તો અમારે રોટી-બેટી વ્યવહાર અલગ બંધાઈ ગયા, એ કેમ તોડાય ? આપ તો અમારે સર્વે સર્વા શિરછન છો. માટે મત મૂકી દેવાની વાત કરતા જ નહિ.’ બસ ! ત્યાં માનાકંસા નરી, અને મત મુકાયો નહિ. માનાકંસાએ આપમતિ ઊભી રાખી.

(૩) સારું લગાડવાની ભૂખે આપમતિ :-

બાકી ચાલુ બાબતોમાં પણ એવું બને છે કે જરાક જરાકમાં હોશિયારી બતાવવા સારું લગાડવા માટે મનમાન્યા સિદ્ધાન્તો એવા ગબડાવાય છે કે જે જિનવચનને બાધ કરતા હોય, બોલવામાં કોઈ સંકોચ નહિ, ‘ઉત્સૂત્ર આવી જશે તો !’ એવો ભય નહિ. વાત એક જ કે ગમે તે બોલીને સારા હોશિયારમાં ખપવું. એથી આપમતિએ ચાલવાનું થાય છે.

(૪) પૌદ્રગલિક લાલસાથી આપમતિ :-

ત્યારે પૌદ્રગલિક સ્વાર્થલાલસા પણ એવી ખતરનાક છે કે એય આપમતિમાં ચડાવી દેવાનું કરે. દાખલા તરીકે શેઠ પાસેથી સારી આજ્ઞવિકા મળે છે માટે શેઠના ગમે તેમ શાસ્ત્રબાધક બંડલ યા દેવ, ગુરુ કે ધર્મની નિદાના બોલમાં ટાપસી પૂરશે, એ ટાપસીમાં શું આવવાનું ? જિનવચનને જરાય બાધ ન કરે એવું બોલવાનું ? ના રે

“ચાર પ્રકારની વિંતા”-૧ આત્મવિંતા

ના ભગવાન ! ભગવાન ! કરો, એમાં તો આપમતિનાં બંડલ ફેંકવાના ? કોણ કરાવે છે આ ? પૌદ્રગલિક તુચ્છ લાલસા. એ જો ન હોય તો સંભળાવી ન દે કે ‘શેઠ માફ કરજો, મહેરબાની કરીને આવું મને સંભળાવતા નહિ.’ અથવા ‘આપ જેવા સજજનને આ શોભે ?’

પણ પછી શેઠ કહી દે કે ‘તો ધેર બેસજો અહીં આવતા નહિ તો ?’

‘તો ગભરામણ શી ? લલાટ આપણું શેઠ પાસે છે કે આપણી પોતાની પાસે ? અને કદાચ બીજે જતાં ઓછું મળે છે તો એ ખોટ મોટી કે જિનવચનને અન્યાય કરે એવા બોલ યા દેવ-ગુરુ ધર્મની નિદાનાં વચન બોલવા-સાંભળવામાં ખોટ મોટી ?

બહુ વિચારવા જેવું છે. અનાદિના વિષય લંપટ જીવને જરા ચાટવાનું મળતું હોય ત્યાં, જેમ ફૂતરો પૂંછી પટપટાવતો ઊભો રહે, એમ હરખી હરખીને વળગવાનું મન થાય છે ! પછી ત્યાં પોતાની ખાનદાની, ન્યાય, ધર્મ, સિદ્ધાન્ત વગેરે કાંઈ જોવાનું મન નથી થતું; એને ટલે ચઢવાનું કરાય છે ! આપમતિના વાણી-વર્તાવ ખુલ્લખુલ્લા આચરે છે, ત્યાં સોનેરી માનવકાળની ને પુષ્યની કેટલી મોટી ખુવારી ! મોહના પડળથી આવેલા આભ્યન્તર અંધાપામાં આપમતિથી થતી ખુવારી દેખાતી નથી પણ જડની લાલસા ઓછી થાય તો સૂર્જે ને ?

(૫) અજ્ઞાનતાથી આપમતિ :- અજ્ઞાનતાથી પણ આપમતિ પોષાય છે. માનાકંસા એવી નથી, જડની લંપટા એવી નથી. છતાં જ્ઞાનીનાં દઢ બંધન નથી, તત્ત્વ-અતત્ત્વની ખબર નથી, માર્ગ, અમાર્ગનું જ્ઞાન નથી, એટલે જાણ્યે-અજ્ઞાણ્યે આપમતિના ઉદ્ગાર નીકળે છે. ચાર દોસ્તાર ભેગા મળ્યા વાતો કરવા, ત્યાં એવું બને છે કે વાતોમાં ને વાતોમાં આપમતિના સિદ્ધાન્ત ડફડાવાય છે. એમ મહારાજ બહુ ભણ્યા નથી, ને કોઈ શ્રાવક આવી કાંઈ પૂછે છે, ને ઉત્તર ન દેતાં

૪૮

“ચાર પ્રકારની વિંતા”-૧ આત્મવિંતા

શરમ આવે છે તેથી અજ્ઞાનતાવશ ત્યાં આપમતિનું બોલાઈ જવા સંભવ છે.

(૬) રાગદ્વેષથી આપમતિ :- એમ તીવ્ર રાગદ્વેષના કારણે પણ આપમતિનું જોર રહે છે. માને દીકરા પર બહુ રાગ છે તો એને ખુશ રાખવા અગર બહાર એનું છાવરવા આપમતિના બોલ બોલે એવો સંભવ રહે છે. એવું દુશ્મન ઉપરના દ્વેષથી એને હલકો પાડવા અગર પોતાનું ઊંચું રાખવા આપમતિના બોલ કઢાય છે, એવા કે જે જિન વચનથી વિરુદ્ધ જતાં હોય.

આપમતિ ટાળવા શું કરવું ? એટલે અહંત્વ, માનાકંક્ષા, પૌર્ણગલિક લાલસા કે અજ્ઞાનતા આદિ કારણ પર આપમતિ ઊભી થાય છે. એ કારણો ખસવાં સહેલાં નથી તેથી આપમતિ ખસેડવી મોંઘી પડે છે.

એનો અર્થ એ, કે આપમતિથી બચવું હોય અને જિનવચનને પક્કા બંધાયેલા રહેવું હોય તો આ અહંત્વ વગેરેના આવેશ અને અતિરેક ઓછા કરી નાખવા જોઈએ. આ ટાળવા મોંઘા છે એમ કહું તે સાચું, પરંતુ એ માટે ઉધમ કરતા રહેવાથી શું ન થાય ? જરૂર ફળ આવે.

- ઉધમથી એકલો હજારને હઠાવી હે.
- ઉધમથી ધૂળમાંથી સોનું શોધી શકાય છે.

અલબંત એમાં કોઈને વાર લાગે, ને કોઈને જરૂરથી સિદ્ધ થાય. પૂર્વ કર્માનો ભાર અને વર્તમાન પુરુષાર્થનું જોર કેટલું છે એના આધારે ઓછું-વધતું ફળ આવવાનું, બાકી એ અહંત્વ, માનાકંક્ષા જડની લંપટતા, વગેરેને ઓછા કર્યે જ ધૂટકો છે. બીજી રીતે ન થાય તો આ રીતે કે 'કોઈ દુર્ગતિમાં ભટકતાં-ભટકતાં આજે મોટી લોટરી લાગવાની જેમ આ મનુષ્ય-ભવ અને અમૂલ્ય જિનવચન માપ્ત થઈ ગયાં છે, તો પછી એને ઓળંગીને ક્યાં જરૂર ? શા માટે આવા મહાપવિત્ર અને એકાંત આત્મહિતક જિનવચનને બાધ કરે એવી આપમતિમાં તણાઉં ? જરાય નહિ, ભવક્ષય કરવામાં અને મંગળ મોક્ષ

પમાડવામાં પ્રથમ સાધનભૂત એવા જિનવચનને જરાય બેવજા નહિ બનું, પાકા બંધને બંધાયો રહીશ. એ માટે ખોટા અંહંત્વને પણ અણગું મૂકીશ; માનાકંક્ષા નહિ રાખું, જડની મારે પરવા નથી, અજ્ઞાનતાનું કશું નહિ બોલું, એવા તીવ્ર રાગદ્વેષ જાય ઝહનમમાં !' આવી કોઈ ઉર્ભિ ઉઠે, કોઈ ટેક ધરાય, તો એ અહંત્વાદિ અને આપમતિને ઓછા થવા અવકાશ છે.

અનાદિના કુસંસ્કાર બળવાન છે, પરંતુ જિનવચનની શરણાગતિ મહાબળવાન છે એમ સમજજો.

તો જ આ જગતમાંથી જીવો મોક્ષ જઈ શક્યા છે; નહિતર મોક્ષ શાનો થાય ? પરંતુ જિનવચનનાં બંધન માથે ધર્યા, એની તાકાત એટલી જબરદસ્ત છે કે કુસંસ્કારોના વજના પાયાય હયમચાવી નાખે ! એનાં મૂળ ઉખેડી નાખે ! એનું કારણ આ જ છે કે એથી આપમતિ અને અહંત્વનાં ગાત્ર ઢીલાં પડી જાય છે, એને ભાગી જવું પડે છે.

મહાપુરુષોના ભાવ મન પર લાવો :-

મન પર આ લાવો કે મહાસતી સુલસાએ પ્રભુ મહાવીર પર કેટલો અથાગ રાગ કેળવી કેવાં એમનાં વચનનાં બંધન સ્વીકાર્યા ! 'જિનવચન ના કહે છે કે મિથ્યા દેવ-ગુરુ-ધર્મનો પડછાયો ન લેવાય, તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશના ગમે તેવા ચ્યમતકારી દેખાવ સર્જ્યા હોય, અને જન પ્રવાહ એ જોવા દોડતો હોય, છતાં મને એની કોઈ જ આતુરતા નથી, ચ્યમકતા સૂર્ય જેવા જિનેશ્વરદેવની આગળ આ ખજવા કોણ માત્ર ?' સુલસાના ભાવો મન પર લાવો. શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવની જિનવચન સ્વીકૃતિ મન પર લાવો. પ્રભુના મહાશ્રાવકો આનંદ-કામદેવ વગેરેએ સ્વીકારેલાં જિનવચન બંધનને હૈથે વસાવો. સુદર્શન શ્રાવક અને અભયકુમારને યાદ કરો. સમ્રાટ સંપ્રતિ અને રાજી કુમારપાળે માથે ધરેલ જિનવચનના ભાર પર વિચાર કરો.

જિનવચનને અનેક ઉપમાઓ :-

જિનવચન તો મિથ્યાત્વરૂપી મહારોગનું ઔષધ છે, અતત્વની

ભાંતિ ટાળનાર મહાપ્રકાશ છે, મોહવેલડીના મૂળમાં અંગારસમ છે ભવબ્રમણ નિવારનાર મહાભોમિયો છે, દુઃખની જડ ઉઘેડી સુખનાં સામ્રાજ્ય સ્થાપનાર વિજયી સેનાપતિ છે, કર્મ જંજરોને તોડવા માટેનું અખૂટ બળ છે; અનંત અનંત કાળની ભવકેદમાંથી છોડાવનાર વિભૂતિ છે. એ શ્રી જિનવચનને મહાવિદ્વાન ગણધરદેવ જેવાએ પણ માથે ધર્યા છે, અને દેવેંદ્રો જેવાએ એનાં અભિનંદન કર્યા છે !

સંસાર-રમણતા નહિ એટલે ? જડના રસ ઊરી ગયા :-

આવા અનુપમ, અનુલ્લંઘનીય જિનવચનને માથે ધરવાનું તો જ બની શકે કે જો જીવનમાં આત્મચિંતા પ્રધાનપણે વર્તતી હોય. પાપનો ભય અને ધર્મબુદ્ધિ સ્થિર થવા ઉપર આત્મચિંતાનો વિકાસ થાય એટલે જિનવચનનાં બંધને બંધાયેલા રહેવાનું બને છે; ચિંતા જાગી ગઈ કે ‘મારો આત્મા અલ્યજ્ઞાની કે અજ્ઞાનીના પલ્લે પડી આ ભવસાગરમાં ખોવાઈ ન જાય. માર્ગદર્શન તો અનંતજ્ઞાનીનું જ ખપે ! એટલે જિનવચનને જ વળગવાનું કર્યું પછી તો આત્મચિંતા એવી વિકસી ઊરી કે ‘સમ્યગ્રદર્શનપૂતાત્મા રમતે ન ભકોદધૌ’ જિનવચનશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા ભવસાગરમાં રમતો નથી, સંસારની સુખ સાહિબીમાં પણ રમણતા નથી કરતો. સંસાર-રમણતા નહિ એટલે ? એ કે એને હવે સ્વાત્માને ભવમાંથી મુક્ત કરવાની તાલાવેલી જાગી છે; આધો જાય પાછો જાય, ને કર્મબુદ્ધ સ્વાત્મા યાદ આવે છે, એટલે જડના મૂળ રસ ઊરી ગયા છે. જેમ જેમ જિનવચનથી નવા નવા પ્રકાશ મેળવતો જાય છે તેમ તેમ સમજતો જાય છે કે,

અહો ! આત્માનું અસલી સ્વરૂપ કેટલું ઉત્તમ ! કેવું અનંત જ્ઞાન-દર્શનમય શુદ્ધ સ્ફુર્તિક જેવું સ્વચ્છ ! અને વર્તમાનમાં એની કેવી અધમ દશા ! ક્યાં એ મૂળમાં નિરંજન-નિર્વિકાર દશા ! અને ક્યાં વર્તમાનમાં કર્મભિલન તથા રાગ દ્રેષ-મોહના ખરાબ વિકારોથી ગ્રસ્ત અવસ્થા ! આત્માની કેટલી બધી સુંદર સર્વતત્ત્વ- સ્વતત્ત્વ મૌલિક અવસ્થા ! અને વર્તમાનમાં એની જ કેવી ભવપરાધીન, કાયપરાધીન

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા

૫૧

અને સંયોગ પરાધીન દુર્દુશા !

આ બધી આત્મચિંતા છે. એના ઉપર (૧) ઉગલે ને પગલે તરફાને છે કે રખે ને ફરી કર્મના ભાર વધી ન જાય ! એમ.

(૨) રાગ-દ્રેષ-ઈંદ્ર્ય-વિષયવાસના વગેરેના વિકાર વધી ન જાય !

(૩) આત્મચિંતા જાગવાથી આશ્રવો, પાપસ્થાનકો સામે આવતાં કંપારો થાય છે,

(૪) ધર્મસ્થાનો સેવવાના ઉમળકા જાગે છે.

(૫) મોહમૂઢ કુટુંબને દેખીને કરમાય છે,

(૬) સંધ-સાધમિકને જોઈ વિકસે છે.

(૭) વિકથાઓ પ્રત્યે સૂંગ ચઢે છે.

(૮) ધર્મકથા-તત્ત્વકથા તરફ ભારે આકર્ષણ થાય છે.

(૯) ધન એ ધન નથી લાગતું, ધર્મ એ ધન લાગે છે.

(૧૦) દોષ-દુષ્કૃત્યો તરફ જ્ઞાનિ ઊપજે છે;

(૧૧) ગુણો અને સુફૂતોની ભારે ભૂખ લાગે છે...

ચાર પ્રકારની ચિંતામાં આત્મચિંતા ઉત્તમ છે, અને તે આ રીતે કરવાની છે.

ખોટી પરચિંતા :-

જેન શાસ્ત્રો આત્મચિંતા પર બહુ ભાર મૂકે છે. ત્યાં સુધી કે બીજાના આત્મહિતની ખોટી ચિંતામાંય નહિ પડવાનું. દાખલા તરીકે સમજો કે આજે કાળ ખરાબ આવ્યો છે, અને વિષમ પરિસ્થિતિ દેખાય છે. ત્યાં જો મનને એમ થયા કરે કે ‘આ કેવા લોકો છે ! સંઘને કેટલું તુકસાન કરી રહ્યા છે ! છે કોઈને પડી ! આમ કરવું જોઈએ...તેમ કરવું જોઈએ...’ આ બધી ખોટી ચિંતા છે. એનું કારણ એ છે કે એમાં પછી માત્ર બીજાની ખામીઓ જોવાનું ને બીજાનો અશક્ય વિચાર કરવાનું રહે છે. ‘અમુકમાં આમ છે. ફલાણામાં તેમ છે, પેલો તો મહા ગુસ્સાખોર...’ આવું ને આવું ચાલ્યા કરે છે, ક્યાંય એ નથી સુદૂરતું કે ‘હું કેવો દોષપાત્ર, મારામાં અમુક અમુક ખામી શા માટે ? મેં અહીં

૫૨

“ચાર પ્રકારની ચિંતા”-૧ આત્મચિંતા
G:\Kalpesh\GuruJaysundar\Part-20\Part-20CharPrakarniChinta-1FinalProof. pmd.(4-2-12)

કોષ કેમ કર્યો ? પણે અભિમાન મેં કેમ બતાવ્યું ? ખાવાની વસ્તુ પર હજુ રાગ કેટલો અને શા માટે રહે છે ?' આવો કોઈ વિચાર કરવાને બિચારા પાસે અવસર જ નથી, કેમ તે મન બીજાના વિચારો કરવામાં ભારે વ્યત્ર બનેલું રહે છે. હજુ વિચારણા બીજાના આત્મહિતની કરશે કે 'આજે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. પેલો ઊંચે ચઢી રહ્યો. ફલાંજો નકામો છે, એણે તો આવી આવી રીતે આગળ વધવું જોઈએ...' આમ પરના આત્મહિતના વિચારો કર્યા કરશે તેમાં વળવાનું ય કાંઈ નહિ; અને પોતાના આત્માનો વિચાર કરવાની વાત નથી.

પરહિત ચિંતામાં કાંઈ જોખવું છે ? :-

ખૂબી તો એ છે કે સ્વાત્મહિત ભૂલી બીજાના આત્મહિતના વિચાર કરનારને પાછી એ માટે કંઈ પોતે જોખવાની વાત નથી, પોતાને કોઈ ભોગ આપવો નથી, કોઈ મહેનત પોતે કરવી છે ? ના, માત્ર બખાળા કાઢવા છે, કરવાનું કાંઈ છે નહિ. શાનો કરે ? 'હું બીજાનું ભલું કરીને મારું આત્મહિત સાધું' એવી સ્વાત્મહિતની લગની હોય તો કરે ને ? આજે જુઓ ચારેકોર ભાષણ અને લેખનમાં ! જુઓ કેટલી રાણે પડે છે, 'આમ બગડી ગયું છે તેમ બગડી ગયું છે. સંઘની પડી નથી, સાર્થિકની પડી નથી. આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ.' પણ રાણે પાડનારામાં તપાસો કે કેટલા પોતાની ક્ષતિ જુઓ છે ને જીતને સુધારવા મથી રહ્યા છે ? પહેલી તો આજ ખામી છે કે વર્તમાન જીવો પર એ ભાવદ્યા નથી કે 'બિચારા જીવો જિનશાસન મળ્યે છતે અજ્ઞાન, ઈર્ઝા, લોભ વગેરેથી પીડાઈ રહ્યા છે ! તો હું એમને કેવી કેવી રીતે સહાયક થાઉં ?' અથવા 'એવા જીવો બિચારા બાળ છે તો એમને સદ્ભુદ્ધ મળો.' આવી ભાવદ્યા ન હોય એટલે દ્વેષ આવીને ઉભો જ છે. બીજાનો તિરસ્કાર-અવગણનાના એક યા બીજા પ્રકારે ચાળા ચાલે-જ છે. આ એક ખામી, અને બીજી એ કે જાતે એકાદ કે બે પાંચને સહાયક થવાની વાત નથી. આવા માણસો, હવે વિચારો કે, સંઘહિતની અને પરહિતની વાતો કરતા હોય એમાં

"ચાર પ્રકારની ચિંતા"-૧ આત્મચિંતા

૫૩

માલ કેટલો ? તથ્યાંશ કેટલો ? અહીં મૂળમાં વાંધો આત્મહિતની ચિંતા ન હોવાનો છે.

જેન શાસન તો કહે છે કે 'ઉત્તમા આત્મચિંતા' સ્વાત્મહિત પહેલું વિચારો. આત્માની ચિંતા મુખ્ય રાખો. દિલથી એ વિચારશો તો જરૂરી મમતા અને સુખશીલતા ઓછી થશે, ત્યાં પરહિતની ચિંતા સાચી જાગશે, પરની સેવા કરી છૂટવા ઉત્સાહ અને ઉધમ થશે. સક્રિય મૈત્રીભાવ અને સક્રિય દ્યાભાવ આવશે.

સ્વાત્માની ચિંતા-પરવા કરવી નથી અને પરહિતમાં યથાશક્તિ કશું કરી છૂટવું નથી, એનો કોઈ વિચાર જ કરવો નથી, તો પરહિતની ચિંતા, મૈત્રી, કરુણા, ભાવના પોકળ રહેવાની. સમસ્ત જીવો સુખી થાઓ, તેમાં દુઃખ ટાળો, એમ કહે છે પણ કોઈનું ય કશું ભલું કરવું નથી, એના કરતાં તો એકાદ બેના હિતનો સક્રિય પ્રયત્ન કરે છે તે ખરી પરહિત ચિંતા કરનારો છે.

અહીં પ્રેરણ થશે કે 'તો શું સૌનું ભલું ન ચિંતવવું ?'

હું કહું છું જરૂર ચિંતવવું, પરંતુ એ સમજને ચિંતવવું કે 'મારે શક્તિ-સામગ્રી પ્રમાણે પરહિત કરવાનો ઉમળકો જોઈશે, નહિતર કદાચ એ ચિંતવના શબ્દ માત્રમાં રહી જશે.'

શાસ્ત્ર કહે છે મુનિઓ ખરા પરહિતકારી છે કેમ કે એ સર્વ જીવોને પોતાના તરફથી અભયદાન આપે છે. એવા પણ સામાન્ય શક્તિવાળા મુનિ હોય યા મોટા જિનકલ્પી જેવા મુનિ હોય કે જે ઉપદેશ વગેરે ન કરતા હોય ને માત્ર પોતાની સંયમ સાધનામાં લીન હોય છતાં એ મહાન કલ્યાણકારી પુરુષ છે, ઉત્તમ પરહિતકારી છે.

વાત આ છે કે આત્મચિંતા ઉત્તમ છે અને એ કરવા માટે બીજા પ્રત્યે દ્વેષભાવ, દ્રોહ, વૈર-વિરોધ વગેરે ટાળી મૈત્રીભાવ કેળવવો જરૂરી છે. એટલું જ જરૂરી વિનશ્ચર કાયા-માયાને ઓળખી લઈ, વિષય-કષાયોને બરાબર પિછાણી લઈ એના પ્રત્યે નફરત કેળવવી તે છે. આ હશે તો મૈત્રી સાચી જાગશે.

૫૪

"ચાર પ્રકારની ચિંતા"-૧ આત્મચિંતા